

ॐ

राग रत्न रस भालिका

रचयिता

आशुतोष भालनभाष

मेधराज

प्रकाशक.

जेशी कालीदास नानलभाष.

## આ પુસ્તક મળવાનું ઠેકાણું

(૧) ઠાકોર શ્રી પ્રતાપસિંહજી જીજ્ઞાલ.

કચ્છપત્રી—તાલુકા મુંદરા.

(૨) મહારાજ શ્રી રામદાસજી રામચરણદાસજી.

કચ્છ ખંભરા—અભાંર થઇને.

તથા પ્રકાશક અને લેખક પાસેથી.

# ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ ગુજરાતી કૉપીરાઇટ વિભાગ ]

અનુક્રમાંક ૯૬૦૨ વર્ગિક

પુસ્તકલું નામ ૨૧૦૧૨૦૦ ૨૨૫ ખાલિડી

વિષય ૬-૧૪

॥ ॐ ॥

# राग रत्न रस भालिका.

रचनार

पारोट भाडनभाध भेधराज.

निवास पाणक्षेत्र, कच्छ.

— ०६९ —

छपावी प्रसिद्ध करनार.

जेशी कालीदास नानलभाध.

ठे. कानल लहवलनो भाणे, इणडागल्ली,

भांडवी सुंभर् उ.

आवृत्ति १ ली,

प्रत १०००

संवत् १९७६.

श्री सत्यचिन्म प्रिन्टींग प्रेसभां सा. सांख्ययंद हरोदावे छाप्पुं.

ठे. धांयकुवा नवा इरवाण—अमहावाड.

मुद्रय ०-१०-०

અમદાવાદ

॥ ૩૬ ॥

શ્રી ગાંધીજી સંગ્રહ

## અર્પણ પત્રિકા !

સૌજન્ય સુધાસાગરે વિદ્યાવિલાસી પરોપકારી ઉદારાત્મા સાહિત્ય, સાંગીત્યવેતા સદ્ગુણાલંકૃત કૃપાસાગર પરમ ઉજ્જવળ માંગલ્ય-મૂર્તિ મહાશય સત મહંત ગુરુવર્ચશ્રી રામદાસજી સદ્ગુરુ રામચરણદાસજી મહારાજ !

આનંદાશ્રમ, શ્રી કચ્છ ખંભરા !

આપશ્રીનો મહારાપર ચિરકાળથી અપુર્વ વાતસલ્યભાવ જગતી રહ્યો છે ! જેમ પુત્રની પિતા પાલના કરે તેવી રીતે આપ મહારાપર સ્નેહ રાખતા આવ્યા છો, રાખો છો અને રાખશો. આપ મહાત્માશ્રીની પરીત્ર પ્રશ્નસા લખવા હું અલ્પજ્ઞ છું. આપ દયા સાગરનો અન્નજલ ન થઈ શકતાં સદૈવને માટે આશ્રિત અને આભારી છું. મહેને યતકિંચિત જે કાંઈ જ્ઞાન થયું તે આપની કૃપાતું જ ફલ સમજ્યું છું અને તેથી જ આ મહારા આરંભેલા કાર્યમા શતેહમંદ થયો છું. આપશ્રીની અપૂર્વ કૃપાથી આકર્ષાઈ દિવાકર ત્રતે દીપમાલિકાની પેઠે આ પ્રભુ સ્મરણ ગ્રંથ “રાગ રત્ન રસ માલિકા” રૂપી પ્રભુ સ્મરણમાળા આપને સપ્રેમ અર્પણ કરી કૃતાર્થ થાઉં છું !

લી:—શ્રી રામચંદ્ર પરમાત્માની કૃપાય આપની આરોગ્યતા, દીર્ઘાય અને અભિધાનંદ ઇચ્છનાર ચરણાંજલ્ય રજીપાસક !

કવિ માહેનભાઈ મેઘરાજ.

નિ. કચ્છ ખાખીયા કિંવા ખાખલેશ્વર.

દોહા !

વિધ વિધ તરજ વિલાસની, રસિક રચી અભિરામ,  
“રાગ રત્ન રસ માલિકા,” ગ્રંથજી કરો ગુરુ રામ. ૧

# નિવેદન.

શાંત પ્રેમમય આ ઇશ્વરી મહાસાગરમાં ઝોત પ્રોત છતાં પણ જેમ  
અમથી મહાસાગરના ઉછળતા પાણીને મેળવતું ઉપનામ આપવામાં આવે  
છે તેમજ ઉત્પત્તિ સ્થિતિ અને લયનાં ત્રાગડાને અધીન માની લઈ આપણે  
મૂર્તિમંત આનંદરૂપ ઇશ્વરથી નિરાળા પડી ગયા છીએ. સૃષ્ટિ માત્રમાં સર્વથી  
મહાન એકજ ઇચ્છા જેવામાં આવે છે અને તે સુખ પ્રાપ્ત કરવું એ છે.  
સુખ એટલેજ આનંદ; અને અનુપમેય આનંદની સ્થિતિ તેજ મોક્ષ-તેજ  
ઇશ્વરપણું. આનંદ એજ આપણો સ્વભાવ છે. દુઃખ આપણા સ્વભાવથી  
વિરુદ્ધ છે તેથીજ દુઃખથી પીડા થાય છે.

આખી દુનિયા આનંદ મેળવવા માટે હરેક પ્રયત્નો કરે છે પરંતુ  
અજ્ઞાનના બિષણ અંધકારમાં સામે રસ્તો શોધવો મુશ્કેલ થઈ પડે છે  
અને ખોટે માર્ગે દોરવાઈ જઈ ચંચળ સુખાભાસ પામી આખરે દુઃખ અને  
દુઃખજ પામવાનું રહે છે. આપણી ભરતભૂમિના પ્રાચીન દેવી પુરૂષોને આ-  
પણે હર પ્રાતઃકાળે પ્રેમથી પૂજીએ છીએ તેનું કારણ એજ છે કે તે પવિત્ર  
મહાન પુરૂષો જ્ઞાનરૂપ સૂર્યના પ્રખર તેજથી અજ્ઞાન અંધકારનો નાશ કરી  
સત્ય સુખનો માર્ગ કેવળ પરમાર્થ ભાવનાથી સરળ રીતે બતાવી ગયા છે.  
ઉચ્ચ નીચ સર્વ પ્રાણીમાત્ર તરફ સ્વાર્થ રહીત પ્રેમભાવ રાખવો અને  
હરેક પ્રાણીમાં ઇશ્વરી અંશ છે એમ સમજી-મનુષ્ય જાતિ તેમજ અન્ય  
પ્રાણીવર્ગો પ્રત્યે સાચા નિઃસ્વાર્થી મિત્રપણે વર્તન કરવું એ પ્રેમ-કર્મયોગ  
છે. પ્રેમની જામી સ્થિતિ તે ભક્તિ; તેમજ ખરો પ્રેમ-કર્મયોગ, તેજ  
ભક્તિ કર્મયોગ છે.

આપણું પોતાનું દિલ નિઃસ્વાર્થી હશે તો જરૂર નિઃસ્વાર્થી મિત્રો  
મળશે. જેમ જેમ આપણા મિત્રો-નિઃસ્વાર્થી મિત્રો વધશે તેમ તેમ આ-  
પણે આનંદ વધશે. સર્વ જીવંત પ્રાણીઓ, જેવા કે મનુષ્યો, પશુઓ,

પક્ષીઓ અને વનસ્પતી માત્ર તરફ સ્વાર્થ દષ્ટિ ઝોઢી થશે તેમ સર્વ પ્રાણીઓ આપણા તરફ ભયને બદલે પ્રેમ રાખશે; અને જેમ ભયથી દુઃખ થાય છે તેમજ પ્રેમથી આનંદ, આનંદ મળશે. આનંદ એ ઇશ્વરી તત્વ છે. આનંદ મેળવ્યા પછી બીજું કંઈ મેળવવા જેવું રહેતું નથી.

દિલના આનંદની કેટલીક લકડરીઓ આ 'રાગ રત્ન રસમાલિકા' માં યોજેલી છે.

આપણા આર્યાવર્તના આદર્શ મહાપુરુષો શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણ પરમાત્માના બલ્ય જીવનમાંના આનંદ તથા પ્રણયરસ વિહારના ઉચ્ચ પ્રસંગોની ચત્કિચિત્તા તાદશતા સંગીતરૂપે ખડી કરેલી છે. સુમધુર રાગરાગણી, જેમકે, ખાગેસરી, ભૈરવી, ભૈરવ, નાયકી, નટકેદાર, સ્યામકલ્યાણ, સોહિની, આજ્ઞામયુરી, પહાડી બરશાણી, પંડુ બુંદાકોટા, રજવાડી કનરો વિગેરે પ્રથક પ્રથક ગોઠવેલ છે.

પત્રી નિવાસી ઠાકોરશ્રી પ્રતાપસિંહજી જીણાજી તરફથી આ પુસ્તકને અંગે અમુલ્ય સુચનાઓ મળેલ તે ખાતર તેઓશ્રીનો આ પ્રસંગે સહૃદય આભાર માનવામાં આરે છે. તથા સુંદર રીતે છપાવી આપવા માટે સમાજ જીવનના માનવતા અધિપતિ શ્રીયુત નારાયણજીભાઈ ગોકળદાસ ડેસાણીનો તથા કેટલીક સુચનાઓ માટે અમારા શ્રીયુત શામજી ઉજમશી કાપડીયાનો ખણ આભાર માનવાતું ભૂલી જઈ શકતો નથી. ૐ શાંતિ.

વ્યાખ્યાયેશ્વર, કુમ્હ.  
સં. ૧૯૭૫, જન્માષ્ટમી.

માડનલાલ મેધરાજ.

॥ ॐ ॥

॥ श्रीहरि ॐ ततसत परमात्मने नमः ॥

# श्री राग रत्नरस मालिका प्रारंभ.



दोहा !

- करी सुभ सुभ हायक सदा, अंद्र मौली तव तात ?  
करनेरी वंदन करों, शैल सुता तव मात ! १
- विघन हरन भंगल करन, असरन शरन उदार;  
राग रत्नरस मालिका, शिव सुत देहु सुधार. २
- गौर अंग अहि आलरषु, नीलकंठ इंड माल;  
शैल सुता वामांक मे, गंगजटा शशि लाल. ३
- नमन करों जगदंभ डों, नुगल नेरी डें पान;  
भानी हीनें भाल डों, करों रामगुन गान. ४
- भोर मुकुट अंसी धरन, धनुष धारि श्रीराम;  
ताडो यश अरनन करों; राम नाम सुभ धाम. ५
- राग रत्न रस मालिका, नाम अंथ यह जन;  
साक्षर वर्ग सुधारिके, पुस्तक करहु प्रमान. ६
- भुध नकलंकी व्यास प्रथु, नरहरि वामन इप;  
भच्छ कच्छ वाराह वपु, रामकृष्ण नर भूप. ७

—(१)—

पद राग धनाश्री.

राम करे लवपार ह्यालु शुड ?

राम करे लवपार.

टेक०



ભવજલ તારો દાસ ઝિગારો, અનુચર અરજ સ્વીકાર.	દયાળુ. ૧
તારણુ તરવા જન હિત કરવા, આપ ધર્યો અવતાર.	દયાળુ. ૨
આપ કૃપાળુ છો માયાળુ, સેવકના પ્રતિપાલ.	દયાળુ. ૩
જન્મ સુધારો દોષ નિવારો, માડન સરન તુમાર.	દયાળુ. ૪

—(૨)—

રાગ ધનાશ્રી:—“ મહત્ત્વ. એ રાગે.

ભજો અવધપતી સુખકારી, જનમ મરણુ ભયટારી.	ભજો. ટેક૦
ભરત સત્રુહન લઘમન બ્રાતા, ખેલત ગેંદ ખરારી; ચરણુ કમલ બલિહારી.	ભજો. ૧
હંસ વંશ અવતાર મનોહર, શાંમ સુરત પરવારી; ધનુષ બાણુ કરધારી.	ભજો. ૨
માત કૌશલ્યા કરત આરતી, અફલુત રૂપ નિહારી; માડન મોહ અપારી.	ભજો. ૩

—(૩)—

આશા:—રક્ષા તમે કરજો એ રાગે.

કૃપા તમે કરજો સુંકર ધનસ્થામ.	ટેક૦
દરશન કરવા શંકટ હરવા, શુભનના વિસરામ.	કૃપા તમે. ૧

લવકુખ ટારી દુષ્ટ વિદારી;  
આપ્યું અખંડ નિજધામ.  
ચક્રહુ ધારી સંત સુધારી;  
માઠન આતમ રામ.

કૃપા તમે. ૨

કૃપા તમે. ૩

--(૪)--

ભૈરવી “બીક નથી એ રાગે.”

સ્વામ સુંદર છબી સોહની.	ટેક૦
મનહર ખંશી તાન મિલાવત,	
આરોહની અવરોહની રે.	સ્વામ. ૧
પાટ પીતાંબર અંગ ગિરાજે,	
લાવ લેહક લલ બ્રોહની રે.	સ્વામ. ૨
જમુના આરે ગૌધેન આરે;	
માંડન છબી મન મોહની રે.	સ્વામ. ૩

--(૫)--

ધનાશ્રી “શુ” કહુ કથની એ રાગે.”

મનમોહન માન નિવારી, દરશન ઘો સુખકારી. પ્રા૦  
મેં તો આશ તમારી ધારી, દરશન ઘો સુખકારી. ટેક૦  
તન મન ધનથી દાસી તમારી, સરણે લ્યો ગિરધારી;  
દોષ નિવારી મેર વધારી, કિંકરી હું છું તમારી. પ્રાન૦ ૧  
પ્રાણુ સનેહી જીવન મારા, નાથ છો ચરમુના તારા;  
હયા કરીને દીન ઉગારી, ચરણુમા રાખો ખરારી. પ્રાન૦ ૨  
રાસ રમાડી આશા પૂરો, આશ્રય એક તમારો;  
માઠન માલિક અરજી સ્વિકારો, પૂરો આશ અમારી. પ્રાન૦ ૩

—(૬)—

આશા “ ભવસાગર એ રાગે. ”

જનમ સુફલ કરવા, રતવન કર.	ટેક૦
નામ જપીલે નિત્ય હરીનો, ભવસાગર તરવા.	સ્તવન૦ ૧
કામ ક્રોધ મદ મોહ તજને, ફેગટ નહી કરવા.	સ્તવન૦ ૨
સાંત સમાગમ કરનિશિ વાસર, માડન મન ધરવા.	સ્તવન૦ ૩

—(૭)—

રાસ વિનોદી “ આંગણા હોય રે એ રાગે. ”

આલી રાસ રચ્યો રે સોહામણો,  
મળવો બન્યો મોહનનો. દોહ૦

સાખી.

સરહ પૂનમની રાત્રી, મનહરની સુખ મૂલ;  
બંસી બાલા સાંભરી, ઉર આનંદ અનુકૂલ,  
દરશન કરી પ્રીતમનો. આલી. ૧

સાખી.

બિંદ્રા બનની કુંજમા, રચીઓ રાસ વિલાસ;  
મોહ ઉમંગ્યો મનવિષે, પ્રીતમ પૂરી આશ.  
દહાડો આજે આનંદનો. આલી. ૨  
માડન સહુ મહિલા મળી, પામી પરમાનંદ;  
મન ઈચ્છિત સુખ માણવી, મળીઆ નંદનનંદ;  
પ્રેમ વાંધ્યો પૂરવનો. આલી. ૩

—(૮)—

કવાલી.

અહો મસ્તાન મન મારા, લજન કર ભાવથી પ્યારા.  
 અમુલખ વખત આ બાચે, બાદ કરતું જદુરાચે. ટેક૦  
 અચાનક પ્રાન આ બાશે, કુટંગી ફર સહુ થાશે;  
 કટી દોરો લઈ લેશે, મસાણે જઈ ફૂંકી દેશે. ૧  
 કરી સતસંગતી સારી, ભણલે કૃષ્ણ મોરારી;  
 નકામી જિંદગી ખોઈ, રહ્યો માડન પ્રથા મોઈ. ૨

—(૯)—

ધનાશ્રી “માલકને રાખવા રાજ.”

મદ તણ ભજો રઘુરાઈ ? જેથી મળે મોક્ષ સુખદાઈ. ટેક૦  
 અવધ વિહારી, હો સુખકારી,  
 અસુર ખિહારી, ભગત આધારી;  
 મન તણ હઈ કૃટીલાઈ. મદ તણ. ૧  
 અબમેલ ગજગનીકા તારી,  
 ભક્ત વત્સલ્યતા જીવો વિચારી;  
 તારી મીરા ખાઈ. મદ તણ. ૨  
 માડ ન સતગુરૂ સરણુ ગ્રહીને,  
 તન મન ધન અર્પન કર જઈને;  
 તેા પ્રથા જન્મ નહી બાઈ. મદ તણ. ૩

—(૧૦)—

આશા “તરનતારન.”

અંક્ર શેખર તું ઉદાર મનોહર.

કષ્ટ હરન, સુખ કરન  
 ભરન પોષન, તારન તરન  
 ભક્ત ઓધારન કરત પાર. ચંદ્ર શેષર. ૧  
 જલ સ્થળ વાસી, વેશ ઉઠાશી;  
 માડન સહુની પ્રભુ કરો છો સંભાર. ચંદ્ર ૦ ૨

—(૧૧)—

ભૈરવી “ કાઠંબરી મહાશ્વેતા. ”

દશરથ નંદન, અસુ નિકંદન;  
 ભવ દુખ ભંજન ભયહારો,  
 નામ નિરંતર, જપો હરીનું;  
 દુઃખ ભય સહુ ટળી ટળી. દશ. ટેક ૦  
 સાખી.

શમ રામ સુમિરણ કરો, મનકેમ વચન વિચાર;  
 ચાર પદારથ પામશો, નામ તણેાં આધાર. દશરથ. ૧  
 સાખી.

માંડન મન વિચારીને, ભજવા શ્રી ભગવાન;  
 દયા કરીને તારશે, આવી પદ નિરવાન.  
 કામ ક્રોધ મદ મોહ તણેને, રટન કરો નિત હરી હરી  
 જન્મ જન્મના દુઃખ ભયંકર, પલમા ભયે બલી બલી. દ. ૨

—(૧૨)—

આશા “ અંતરના આધાર. ”

પ્રાન ભવન મમ પ્રાન ઓધારો,  
 કષ્ટ હરો પ્રભુ ગિરદ સંભારો. પ્રાન. ટેક ૦

ઘાસી તિહારી દિલ દુખી આરી;	
લવજલ તારી, લીયોને ઉગારી,	
ચૂક સુધારી પ્રભુ અરજી સ્વીકારો.	મમ પ્રાન. ૧
અધમ ઝોધારી, અહલ્યા તારી;	
નખ વધારી દુષ્ટ વિહારી;	
દોષ નીવારન કાજ સુધારો.	મમ પ્રાન. ૨
કુંજ વિહારો, ગિરવરધારી;	
કંસ પછારી, નાગ નિકારી;	
બચત માંડન ચરન તિહારો.	મમ પ્રાન. ૩

—( ૧૩ )—

ભૈરવી “ મારા મનના મનોરથ ”

મહારા મનના મોહન રસીયા રે,	
મહારા તનના તાપો નસીયા.	હા. મારા. ટેક.
નામ તમારું, મન હરનારું, જન્મ સફલ કરનારું;	
મહારા હૃદય કમલમાં વસીયા રે,	મારા. ૧
દોષ અમારા દુર કરીને, લવજલ જઈએ તરીને;	
કે માંડન જગ નવ ફસીયા રે.	મારા. ૨

—( ૧૪ )—

કાલિંગડો.

ચાહોં મિત્ર મિલન ખ્યારી, મેરી અરજી સ્વીકારી.	ટેક.
મેરે પ્રાનજીવન જદુરાઈ, છુપે કપટ કરી ચતુરાઈ;	
મેતો યન યન ફિર હા.....રી.	ચાહોં. ૧
કબ સ્યામ મિલે સુખ દાઈ, કરોં યાહ સખીમે કનાઈ;	

पूरे आश पुरा.....री.	आहों. २
सभी विरहा सुनी विहारी, द्विये भाउन दरश मुरारी;	
कुण्डु भिले सुभकारी.	आहों. ३

—( १५ )—  
 भालकोष पीलु.

अलत अले गिरिवर धा.....री.	टेक०
लय यंभेदी मनहर क्यारी,	
लंभर करत गुंण.....री.	अलत. १
मैयुर मनोहर करत विचारी,	
केकिल रव अती ध्या.....री.	अलत. २
धन गरजत यपला यमकेरी;	
अरसत जण सुभका.....री.	अलत. ३
भाउन भालिक गिरह संलारी;	
अरन कमल पर वा.....री.	अलत. ४

—( १६ )—  
 राग आशा " विनोदी "

ध्यारे प्राणु अवन गित और;	
अलावेां तुमकेां नंके केसोर.	टेक०
रसीक रसीले मन अश कीना;	
आश लगी तव दरशन और.	ध्यारे. १

साभी.

गिंद्रावनकी कुंजमे, अवन करत अकेर;	
मनहर मुरत मन अषी, भाउन के शिर और.	ध्यारे. २

—( ૧૭ )—

રાગ સોયેની

અરણ મહારી, સ્વામી સ્વીકારી;	
લેને લહારી, ભવ દુઃખ વારી.	ટૅક૦
હાસી તમારી, છું દુઃખીઆરી;	
લ્યો ઉરધારી, અવધ વિહારી.	અરણ. ૧
નાથ પધારી, આવો અવારી;	
માડન તારી, લ્યો ખલેહારી.	અરણ. ૨

—( ૧૮ )—

પદ રાગ પરજ રાસ.

ખલીહારી હરી ગુરૂ સંતની રે.	
સુખ દાયક મહીમા મહંતની રે.	ટૅક૦
સદા રામ ગુરૂ સુખ ધામ છે રે;	
મંગલ મુરતી ઉદાર અભિરામ છે રે.	૧
મહારે માથે સમરથ ગુરૂ રામ છે રે;	
અન્ય લોકો સાથે શુ કામ છે રે.	૨
ઠલી કાલ સાગર મહા કુર છે રે;	
તેમા રામગુરૂ હાજરા હજુર છે રે.	૩
સતસંગથી આનંદ સુખ થાય છે રે;	
જન્મે જન્મના પ્રાયશ્ચિત બાય છે રે.	૪
રામ ગુરૂ માંડન ગુણ ગાય છે રે;	
મન વંછિત નિત સુખ થાય છે રે.	૫



—( ૧૯ )—

રાગ કેદારા.

મન રટતું અવધ વિહારી

ટેક૦

હશરથ નંદન જનમન રંજન;

ભવદુઃખ ભંજન, દુષ્ટ નિકંદન

માડન જન સુખ કારી.

મન રટતું. ૧

—( ૨૦ )—

રાગ સારંગ “ અજબ ખની છે.

રામ ગુરૂ ખલીહારી તિહારી

રાખો શરણુ પ્રભુ ખિરક સંભારી.

ટેક૦

સ્વામી સ્નેહી પર ઉપકારી;

વંછિત કૃષ્ણને આપો પ્રદ ધારી;

અસરણુ સરણુ પ્રભુ આશ તમારી.

રામ. ૧

અનુચર માડન દાસ તમારો;

ભવ સાગરથી પાર ઉતારો;

દયાસિંધુ દોષ મહારા દીયો ને હો ટારી.

રામ. ૨

—( ૨૧ )—

નાયકી કનરો “ મંદમંદ ”

અંદ્ર વહન મન હરન ખ્યારી;

પુજન આલી ત્રપુરા.....રી,

ટેક૦

આશુતોષ અરજ મહારી;

શ્રવણે ધરો સુખ કા.....રી.

અંદ્ર. ૧

ધંચિત કલને આપો કૃપાળુ;

અરજી અમારી સ્વીકા.....રી।

અંદ્ર. ૨

માડન ખાલા અરજ કરે છે;

આશ પૂરણ અમુરા.....રી.

અંદ્ર. ૩

—( ૨૨ )—

રાગ કલ્યાન.

જપ મન પ્રણવ ઉચાર,

ચાર પદારથ તા સુ મિલત હે;

અરથ ધરમ મોક્ષ દાર.

ટેક૦

જનમ મરણ દુઃખ તાસુ ટરત હે;

માડન અખંડ ઉચાર

જપ મન. ૧

—( ૨૩ )—

રાગ સારંગ.

કાન કુવરને મળવું સખી ! કાન કુવરને મળવું;

ઘર કામ ગમે નહી કરવું.

સખી. ટેક૦.

મિત્ર મોહન ને મિલવા માટે, કોની ઓથે જાવું;

સખી સાહેલી સંગ લઈને, માડન પ્રણુને છળવું. સખી. ૧

—( ૨૪ )—

રાગ નટ કેદાર.

ધન ઘોર ગુમંડ ધન ગરજતવા;

ગરજત વા મન હરશત વા.

ટેક૦

જુલત જુલે કાન કુવરવા;

દરશ પરશ ઉર આનંદવા,  
આહત માહન ચરનવા.

ધન. ૧

—(૨૫)

રાગ સારંગ ખ્યાલ.

તવ ધન્ય યશોદા માત,  
પાય તનય બહ પુન્ય પ્રતાપે;  
બલભદ્ર કેરે જ્ઞાત.

ટૅક૦

જ્વાલ બાલ સંગ હિલમિલ ગાવત,  
માંડન યમુના ઘાટ;  
બંસી બબાવત સુર ભર ગાવત,  
રાગની રાગ જમાત.

તવ. ૧

—(૨૬)—

રાગ વસંતી રાસ.

સૈયર આલો રમીએ ઉમંગે,  
આનંદ લઈએ ઉછંગે.

ટૅક૦

સાખી.

દેવી મંદિર સંચરી, મનહર રમવા રાસ,  
વિધુ વદની મિલી પ્રેમથી, રમતી રાસ વિલાસ;  
રમે બાલા સૌ પ્રેમ પ્રસંગે.

સૈયર. ૧

સાખી.

મન વંછિત ફલ પામિને, બાલા પરમ ઉજાહ,  
ચંદ્ર વદન ચતુરા મળી, રાસ રમે ચિત આહ;  
ગાઈએ ગરબા હો આલિ રસ રંગે.

સૈયર. ૨

सभी.

भाउन मन वंछित इल्या, आली उमंग अपार,  
हरिं परस आनंद लध, आवी निज आगार;  
सहु आनंद पायी अंगे. सैयर. ३

—(२७)—

मालकेश पीलु.

लज मन राम गुड सुभ का.....री. टेक०  
लव लय लंजन गिरह तमारो,  
अनुयर प्रलु ल्यो ता.....री. लज. १  
आश्रित जननें अलय करो छो,  
आवुं गिरह विया.....री. लज. २  
अनुयर भाउन अरज करे छे.  
बूके क्षमा करो म्हा.....री. लज. ३

—(२८)—

राग देश भलार.

सभीरी मोअे नींद न आवे,  
पिया गिन लुआ गलरावे. टेक०  
प्राणु लवनकुं कोरि मिलावे,  
जनम जनम वांडो गुन गावे;  
हरश परश सुभ पावे. सभीरी. १  
ओर सभी सभ हिल मिल गावे,  
स्थामा की सभ भात सुनावे;  
प्रेम पदारथ पावे. सभीरी. २

માંડન મિત્ર મિલાવન હારે,  
કૃષ્ણ કૃષ્ણ કહી મન લલચાવે;  
હમકોં બિરહ સતાવે.

સખીરી. ૩

—(૨૯)—

ભૈરવી “ જગો જગો ”

પ્યારા મહારા ચતુર સુબન,  
મુરછા ત્યાગો જીવન પ્રાન. ટેક૦  
લછમન જગો જીવન મારા, પ્રાણ તણા આધાર;  
જાઉ અયોધ્યા પુછશે માતુ, કુશળ પ્રાણાધાર. પ્યારા. ૨  
આગળથી જો જાણુ આવું, વચન ન માનત વીર,  
માંડન પ્રભુ સોચ કરે છે, લાગ્યું હૃદયમા તીર. પ્યારા. ૩

—(૩૦)—

રાગ પહાડી.

જાના ખલક છોડી, નહી સ્થિર કો રહેના. ટેક૦  
લજીલે ભાવસોં પ્યારે, હરીકા નામ લેના,  
વિષયમેં કયોં ફસાચે, મન માન એ કેના. ૧  
મહેફલ તજી જાના, મિલોના ફેર કબ હોના,  
સમજ માંડન ગુરૂ સાવા, પદ મોક્ષકા પાના. ૨

—(૩૧)—

રાગ સહર.

કરી લે ગુબારા, કિન ચારકા નિવેશ. ટેક૦  
નહી હે કોહુ તેરા, તજીલે માન મન મેરા,

બની કયેં દ્રવ્ય ચેરા, નહી નાથ કું હેરા. ૧  
 અનોપમ પાચ યહ વેરા, સરન તું લે ગુરૂ કેરા,  
 કરીલે સંત સેવા, માડન મિટે ફેરા. ૨

—(૩૨)—

રાગ સહર.

અરે તું ખોલ નેના, કયેં નિંદમેં ઘેરાના. ટેક૦  
 સમજ કેં દેખ તું રયાના, તણ દે મોહ મહ માના,  
 કરે કયેં ગુમાના, દિન ચારકા રેના. ૧  
 કરી કેં કોલ તું આયા, પ્રભુકા નામ બિશરાયા,  
 તથા તેં જન્મ પાયા, માઠન નિરખ નેના. ૨

—(૩૩)—

પદ રાગ સહર.

અમુલખ બક્ષ પાયો, મન મોજમેં ગુમાયો. ટેક૦  
 કરી તેં કુર વેપારી, પ્રભુમેં પ્રીતના ધારી,  
 તથાતેં દેહ પાયો, મહમોહમેં ભુલાયો. ૧  
 સમજ નિજ આતમા ભાઈ, તણ દે કોધ કુટીલાઈ,  
 કરી માડન મન ભાયો, રંગ રૂપમેં ક્ષાયો. ૨

—(૩૪)—

ધન્યાશ્રી. “દેવી.”

સંત સરન સુખ, હરન મરન દુઃખ,  
 પાર ઉતારન, કષ્ટ નિકંદન. ટેક૦  
 રામે મિલાવન, ભવ જલ તારન,

જન્મ સુધારન, દોષ નિવારન.	૧
જનમ મરન દુઃખ, કરત વિહારન,	
રામ ચરન રજ, શોક નશાવન.	૨
હરી ગુરૂ સમજન, મહા દુખ ભંજન,	
અનુચર માડન, રામ સરન.	૩

—(૩૫)—

રાગ ભૈરવી “ઐતેરો”

મન બશ કીનાં વે કાનરવા,  
ખંસી બજવત સુર ભર ગાવત;  
શ્યામ સુંદર મન ભાયો રે. ટેક૦  
સાખી.

મધુ બનકી શોભા બની દિલ રંજ ન સુખ રાસ,  
જાયે ચંબેલી માલતી, મન હરની ચૌપાસ. મ. ૧  
સાખી.

સંગ સખા રસ બસ બને, ખેલે રાસ નવીન;  
માડન ઉમગ્યો મોદ ઉર, દીને હરશ પ્રવીન. મ. ૨

—( ૩૬ )—

પદ આશા “હું ભજન કરીશ”

મન સરન લે તુ ગુરૂનું સદા.....પ્રીતે.....ટેક૦  
આશા ત્રસના દુર કરીને, સંત ચરણમાં રેવું અરે;  
મન સરન લે ગુરૂનું સદા.....પ્રીતે..... ૧  
સમજ મન તું શીખ મહારી, ધ્યાનમા તું લે ધરી;  
ભવ વારધીથી પાર થાવા, હોયે ઈચ્છા તાહરી;

કર ભજન હરીગુરૂ સંતતું, તો ભય ભવસિંધુ તરી;  
મહ માન માડન તણ ભજ હરી જનમ નાવે આ ફરી. ૨

—( ૩૭ )—

પદ ધન્યાશ્રી.

સમજ ગુરૂની સાન મુરખ મન.	ટેક.
ગુરૂ કૃપાયેં મોક્ષ મળે છે; સત્ય વચન તું માન.	૧
સંત ચરણ રજ ધારી હૃદમાં, અહનિશ ઉર ધર ધ્યાન	૨
કામ ક્રોધ મહ મોહ તણને, ભાવે ભળે ભગવાન	૩
ગુરૂ કૃપાયે માડન કેછે, તળે જાતિ અભિમાન.	૪

—( ૩૮ )—

માલકોશ

રામ રટન કર મન મેરા, પુનરપી જન્મ મિટે ફેરા.	ટેક૦
નામ જપા પ્રહલાદે પ્રીતે, જન્મ સુધારકે ભય ભવ પારા	૧
બ્રહ્મ અનોપમ ચહ પાયા, આયે ઘડી ચહ તરનેકી વેરા	૨
માડન રામગુરૂ બલેહારી, કષ્ટ નિવારન જન કેરા.	૩

—( ૩૯ )—

કવાલી.

અરે મસ્તાન મન મેરા, તણદે માન તન કેરા;	
અમુલખ પાય ચહ ખેરા, કરી લે નામસે નેરા.	ટેક૦
અચાનક વક્ષ ચહ આયા, ગુરૂકા નામ ના ગાયા,	
તરૂણી તંનમેં મોયા જમારા તેં વૃથા ખોયા.	૧
બુવાની રંગમેં રાતા, સુની નહી સંતકી ખાતાં,	



બની તું મદમેં માતા, જિને નહી માતનેં તાતા. ૨  
 જમે જમ આયગા ભાઈ, ઠારકેં કંઠ મેં પાઈ,  
 નહી માડન મદદ કેઈ, ચલેગા સર્વ તું ખેઈ. ૩

—(૪૦)—

કવાલી “ કિલપેં દાગ દેના ”

મન દેખલે દીવાના, ધરતું ગુરૂ ધ્યાના. ટેક૦  
 ભલ લે કૃષ્ણ મોરારી, જનમકેં લે સુધારી,  
 મિલેના ફેર ચહ ટાના, ધરતું ગુરૂ જ્ઞાના. ૧  
 તલ દે જીઠ વેપારી, કરી લે સંતસેં ચારી,  
 તલકે માન અપમાના, ધરો માડન ગુરૂ ધ્યાના. ૨

—(૪૧)—

લૈરવી “ હવે તો જો જરા જાગી. ”

ભલ લે દેવ મોરારી, તલ દે માન દુઃખકારી, ટેક૦  
 બની તું મસ્ત માયા મેં, લગા ચિત જીવતી જાયામેં ૧  
 સરન ગુરૂ દેવકો ધારી, ભલ લે કૃષ્ણ સુખકારી. ૨  
 મનુષ્યા દેહ ચહ પાયા, વૃથા માડન બહી જાય. ૩

—(૪૨)—

ધન્યાશ્રી “ શું કહું કથની ”

સંત ઝોધારન કારન રામ અવધ જનમ સુખકારી,  
 ભક્ત આધીન ખશારી રામ. ટેક૦  
 વિશ્વામિત્ર કે યજ્ઞ સુધારન, તાડકા આપ વિદ્યારી,  
 રાક્ષસ મારી દુષ્ટ નિવારી, અહલ્યા લીન ઉગારી. રામ.

અવધ જનમ સુખકારી. ૧

ધનુષ તોરી જાનકી વ્યાહી, માડન હોત વધાર્ધ;  
રાવણુ આદી યૌ બલકારી, ગર્વ હર્યો અમુરારી. રામ. ૨

—(૪૩)—

પદ રાગ દેશ.

ધન્ય દશરથ નૃપરાધ, જીન રામચંદ્ર સુત પાધ. ટેક૦  
ધન્ય અયોધ્યા ભાગ તિહારો, જહા વિચરત ચારો ભાધ;  
ખેલત ગેંદ સથે હિલ મિલકે, આનંદ ઉર ન સમાધ. ધન્ય ૧  
ઉતર દિશીશે આધ સરણુ, અવધ સમીપ બહાધ;  
માડન વામે સ્નાન કરત હે, જન્મ મરણુ મિટ જાધ. ધન્ય ૨

—( ૪૪ )—

રાગ મલાર “ ખ્યાલ ”

આજ સખી ખીંદ્રાબન મોહન

ધેન ચરાવે કાનરવા. મા. ધેન ચરાવે. ટેક૦

એન બજાવત નટવર નાગર, સંગ વાલ સખ ગાવે;  
રંગ જમાવત મુદ ઉપજાવત, બાહત અંતર આનંદવા. મા. ૧  
હાદુર મોર કોયલીઆ ખોલે, માડન બન ચહુ ચોરા;  
જાવ ચંપા ગુલાબ મનોહર, પુલ રહે યેલરવા. મા. આ. ૨

—( ૪૫ )—

રાગ દરબારી.

મન મોહન પ્રેમ વિલાસી.

એન બજાવત ગૌ ધેન ચારત, કનકુવર ઘટ વાસી. ટેક૦

ધન્ય પીંદ્રાળન ભાગ તિહારો, માહન બસત બિલાસી;  
 મોરશ ભેચન ચઢી ગોવાલન, દરશન તે' અવિનાશી. ધન. ૧

—( ૪૬ )—

નાયેહી ફેસન:

મોર સુકુટ સિર સુંદર રાજે, પીતાંબર તન ધારી;  
 કંસારી પુતના મારી, ગજ ગનીકા પ્રભુ તારી. ૧

સંખામુરકોં આપ વિહારી, શોક નિવારી સુખચારી;  
 મોર સુકુટ સિર સુંદર રાજે. ૨

અનુચર માહન દોષ નિવારી, જનમ મરણ હીઓ ટારી;  
 મોર સુકુટ સિર સુંદર રાજે. ૩

—( ૪૭ )—

કાફી " દેવી આનંદ "

આજ સખી મન મોહન પ્યારો, ધેન ચરાવત નંદ ફુલારો. ટેક૦  
 ઊંન બજાવત સુરભર ગાવત, રાગ જમાવત કાનર કારો. ૧

સમ સ્વરનકોં લેહ બતાઈ, ગાવત રાગની રાગ કેહારો. ૨  
 બક્ત ઓધારન ભવજલ તારન, અનુચર માહનદાસ તિહારો. ૩

—( ૪૮ )—

કૌસિક કનરો.

છાંડો છાંડો હાં-હાં-રે છાંડો છાં-ડો, સુંદર ઘનશ્યામ હો. ૧  
 તુમ કબકે બને હો કાની, હાં.-હાં.-રે તુમ ટેક૦

હમ પ્રજ બાલા બાલ કુમારી, આર કરત હો આપ હમારી.  
 માહન ઘો' ગીન કાનહી, હમ દેખી તુમારી નાકાની;

હાં.-હાં.-રે તુમ. ૨

—(૪૫)—  
કાફી—ગુલાબી.

તણ દે માન મન મેરા, અમુલખ જાત યહ વેરા;  
લણલે નંદ દુલારા, બયો યહ જાત સંસારા. ૧  
બની તું અધ માયામે, છકી રયો રંગ છાયામે;  
લગો નહી ચિત્ત માલામે, ત્રયા તેં જિંદગી ધારી. ૨  
અનોપમ દેહ યહપાઈ, લણલે પ્રદ્ધ સુખદાઈ;  
તણ માડન કુટીલાઈ, સરન લે સંતકા પ્યારા. ૩

—(૫૦)—

કબાલી “ વિવેકી વિશાલ ”

અહો નંદલાલ કરી ખીડાલ,  
તણ પ્રજખાલ દુઃખીઆરી;  
અહો મમ શ્યામ પૂરણ કામ,  
હો સુખ ધામ અંતર રામ. ટેક૦  
સાખી.

મેં દુખીઆરી નાથણ, સ્વામી હ્યો સંભાળ;  
દુઃખ નિવારો દીનના, લીઓ શરણમાં લાલ.  
માડન કરો વાર, અહો કિરતાર;  
ભવ જલપાર, ઉગારો નાર. અહો ૧

—(૫૧)—

સરજતી આશા “ આવા કામ ”

જ્ય કામારી, અરણ સ્વીકારી;

ભવજલ તારી, લ્યેને ઉગારી.	ટેક૦
ભાંલ સુધાકર વ્યાલ અલકૃત;	
ગંગ જટા શિર ગરજત ધારી.	જય ૧
ગૌર મનોહર રૂપ અનુપમ;	
સંગ સુશોભિત શૈલ કુમારી.	જય ૨
વેશ અમંગલ મંગલકારી;	
માહન આયે શરન તુમારી.	જય ૩

—(૫૨)—

૫૬ કાફી હોરી વસંતી.

આજ સખી મન મોહન પ્યારે,	
ખેલત હોરી નંદ કુમારે.	ટેક૦
ખેલત ફાગ પરસ્પર સુંદર, મોહન પ્રાન હમારે;	
આનંદ છાઈ રહ્યો સખ પ્રજામે, કયા બરનો બિસ્તારે;	
ચહ સુખ અપરંભપારે.	આજ ૧
આજ ન જૈયો જલ જમુનાકે, કરત કાન જકબોરી;	
માહન મોહન ગાગર ફૈરત, ઝૈયા હેત મરોરી;	
રંગ જમ્યો જમુનાકે કિનારો.	આજ ૨

—( ૫૩ )—

આશા પીરોઈ ચટક “ ભજન કર ”

જનમ સુફલ કરવા, રટન કર “ ૨ ”	ટેક૦
સંત સરન સુખ દુઃખ નિવારન,	
તાપ ત્રિવિધ ટરવા.	રટન કર ૧
જન મન રંજન ભવ દુઃખ ભંજન;	

लकित आनंद भरवा.

रटन कर २

रामशुद्ध नित राषो रंगेधी;

भाडन ये पद्वा.

रटन कर ३

—(५४)—

सोयनी.

गौा हित डारी, जन्म भोरारी;

लकत ओधारी, लवजल तारी.

टेक०

कुंज विहारी, गिरिवर धारी;

कंस पछारी, दास उगारी.

गौा. १

पंडव नारी, यीर वधारी;

जन सुभकारी, अरुण स्वीकारी.

गौा. २

नाग ओधारी, जुड विहारी.

गिरह संभारी, श्री वनमाढी.

गौा. ३

सरन तिहारी, दोष निवारी;

भाडन सुधारी, ल्यो लडि वारी.

गौा. ५

—(५५)—

आशा भयुरी रंगनी. " लुलावो. "

कान कुंवर शीर भोर, हुमारै प्यारे;

लये क्येां कडोर, प्यारे.

टेक०

सधन घटा धन यपला यमकत,

हीट मुकुट यितचौर. प्यारे.

१

साणी.

मान हीयो मे' भावुनी, तलु गये यित चौर;

હરશ હયા કર દીજીએ, માહન નંદ કિશોર.

ધ્યારે કાન કુંવર

૨

—(૫૬)—

રાગ ભૈરવ.

મન મોહન પ્રાન હમારે, હરશ તિહારે; ટેક૦  
જન્મ સુધારે, સંકટ કાટન હારે.  
મોર સુકુટ સીર સુંદર છાજે, પીત પીતાંબર રાજે;  
એન બળવત રાગ જમાવત, રાગની રૂપ ઉચારે. ધ્યારે ૧  
જમુના આરે ગૌષેન આરે, નંદ કુંવર મત વાલે;  
ગ્વાલ બાલ સંગ હિલમિલ ખેલત, માહન મન હરનારે. ધ્યારે ૨

—(૫૭)—

રાગ ભૈરવી “ કિશોરી ”

શ્યામ સુંદર પર બાઈ બલીહારી. અને હાં-હાં. ટેક૦  
મોહની મુરત મન હરનારી, ચરન કમલ પર બાઈ વારી વારી અને. ૧  
મંગલકારી મદન મોરારી;  
પીત વસન ચિત હરત હમારી. અને હાં-હાં. શ્યામ. ૨  
અકુટી વિશાલ અધર અરૂનારી;  
કેશર તિલક નિરખી ગિરધારી. અને હાં-હાં. શ્યામ. ૩  
રામ ગુરૂ મમ દોષ નિવારી;  
માહન આયે ચરન તિહારો, અને હાં-હાં. શ્યામ. ૪

—(૫૮)—

આશા “ હરીભજ. ”

તણ દે માન મતવાશ, સજીલે સંત જન ધ્યાસ. ટેક૦

હરીગુરૂ સંત સુખકારી, ઉતારે નાવ ભવ પારી;  
 પિતા જ્યેાં પુત્ર ઉર ધારી, ઉગારી લે અંશીવારા. ૧  
 બની તું મસ્ત માયામેં, ધુમંડી રંગ કાયામેં;  
 જનેતા તાત જાયામેં, સમજ મન સ્વપ્ન તંસારા. ૨  
 અમુલ્ય દેહ યહ આઈ, માડન મહા પુન્યસેં પાઈ;  
 રામ ગુરૂ નામ લે ગાઈ, પલકમેં હોયગા પારા. ૩

—(૫૯)—

વિનોદી આશા “જીવો અજબ”

જીવો જનમ મરન દુઃખ સંત મિટાવે. ટેક૦  
 માન તજીનેં ભજ શ્રી હરીને;  
 ધ્યાન ધરીને પ્રભુ એ કરીને  
 કરૂણા કરીને પ્રભુ બાલ બચાવે. જીવો ૧  
 માડન ઉગારે, ભવજલ તારે,  
 દોષ નિવારે, જન રખવારે;  
 ભકત વત્સલ્ય ભગવાન કહાવે. જીવો ૨

—(૬૦)—

કિશોરી કનરો “કોઈ અજબ ભેદ,”

મન સંત ચરણ ચિત ધારોરે, શોક નિવારો. ટેક૦  
 પીયો પ્રેમ સુધારસ પ્યારોરે, શોક નિવારો.  
 તજ કામ ક્રોધ મદ ભાંઈ, કર સંત ચરણ સેવકાઈ  
 ભજ સ્યામ સુંદર મતવારોરે. શોક નિવારો. ૧  
 ધર દયા માડન મન માઈ, કર રામ ભજન સુખદાઈ  
 મિલ જાવે મોક્ષ દુવારો રે. શોક નિવારો. ૨



—(૬૧)—

માલકોશ “ છે અજબ કૃત્તિ ”

છે અવધ પતિ સુખકારી “ બેવાર ”

કષ્ટ નિવારી, સંત સુધારી ખાવિંદ ખલક ખરારી.

છે અવધ પતિ સુખકારી, ટેક.

દુષ્ટ નિકંદન દશરથ નંદન, અખીલેશ્વર અવતારી;

જનક સભા શિવ ચાંપ ચડાવ્યો, મહિપત માન ઉતારી.

છે અવધ પતિ સુખકારી

યજ્ઞ રક્ષા કરી ગૌતમ ત્રિયા તારી અધભરી;

અદ્ભુત રચના જગ ઉધારણુ વિવિધ રીતે વિસ્તરી

છે અવધ પતિ સુખકારી.

૨

—(૬૨)—

સીંદારીઓ કનરો

આલી આય બર્યો ઉર કુંવર કનાઈ

દરશન કેા લગી આશ દુલારી.

ટેક.

મનહર લીનોં મોહન ખ્યારો;

કેશવ કુંજ વિહારી.

આલી ૧

બેન બલવત મોર સુકુટ શિર

શોભિત માહન મહન સુરારી.

આલી ૨

—(૬૩)—

સારંગ “ ચોતાલ ”

મિંદ્રા બનમોહ છાયો, ઉપબલ ઉમંગ ભંગ;

समीर मुगधी व.य, आनंद उपायरी.	भि' १
कुल नकी एहार छाध, भ्रमर लोभाध आध	
लक्ष्मीत वसंत पाध, मीर सोर लायरी.	भि' २
नंदको कुवर प्यारो, एवन आधार मेरो;	
पंसीको धरनहारो, कुंज अनरायरी.	भि' ३
सुर लर गावे श्याम, लुखी प्रज आम काम;	
भाडन एवन प्रान, ज्वाल संग गायरी.	भि' ४

—(६४)—

धनाश्री—चोताल

सुभरन नित तेरो, ओर न आधार मेरो;	
नंदको कुमार प्यारो, संकट नीवारोरी.	सु. १
गजेन्द्र को दुष टायो, गडूड को संग छांडयो;	
जुंडु को विहारो आप, हीनको ठगांरोरी.	सु. २
अहलाहकी वार आय, भक्त काज राज धाय;	
हास के आधारवेको, जन्म प्रज धारोरी.	सु. ३
नंदल के प्यारे लाल, संगमे गिराजे ज्वाल;	
भाडन भयाये जाल, आशरो तिहारोरी.	सु. ४

—( ६५ )—

आशा " तरणु तारणु "

आशा पुरणु करनारी जग हंजे  
 बीड भान्जनी करवार  
 भंगलकर संकट हर त्रिशुलधर  
 दुष्ट विहारन हा.....री रे आश

માતૃ માયાળુ આનંદકારી માડન વંછિત.  
આપો તતકાલ. આસ પુરણ.

૨

—(૧૬)—

કાલીંગડો-મરેઠી સાખી

અધમ ઝોધારન નામ તમારું,  
ભકત વત્સલ્ય લય હારી.  
અજમેલ ગજ ગનિકા તારન  
ભકત પ્રલાદ ઝોધારી, કઈ સંકટ ટારી.....

કરો આશ પુરણ મારી

૧

નાથ નિરંજન જનમન રંજન

માડન મમ સુખકારી

નંદ કે નંદન ગર્વ હું ગંજન

ભંજન ભવ ભય હારી, લહી ગોવરધન ધા.....રી,

તૃજ લોગ લીયે તારી.

૨

—( ૧૭ )—

રાગ દેશ મલાર

મોહની બેન બજાવે, સખીરી કોઈ મિત્ર મિલાવે;

રેનમેં નિંદ ન આવે.

સખીરી ટેક.

ધન ગરજત નભ ચપલા ચમકે;

ધડક ધડક મુજ છતીઆં ધડકે;

શ્યામ વિરહ તાવે,

સખીરી ૧

મનહર લીનો મોહન પ્યારે

માડન મન જસ નંદ દુલારે;

જમુના પુર બહાવે.

સખીરી ૨

—(૬૮)—

## મરાઠી સાખી

સત્ય દેવ તવ નામ મનોહર

ચરન કમલ પર વારી

મનહર મુરત મંગલ કરની

મહિમા અપરંખપારી, કલી દુઃખ નિવારી;

સ્વામી ચરણ સ્વીકારી. ૧

ધમ્મિછત ફલને આપો કૃપાળુ,

માઠન જન રખવારી;

દુધ પુતર લક્ષ્મી આપો, અંતે ચરણ તમારી;

ભવપાર ઉતારી, પ્રભુ દોષ દીયો ટારી. ૨

—(૬૯)—

આશા—“ આવ્યો છું ”

સાચો છે આજ, નિજ ભકત કાજ. ટેક.

કષ્ટ નિવારી કાજ સુધારી

શર મુષ્ટીને પ્રભુ તાયો ગજ રાજ. સાચો ૧

અધમ ઓધારન જનમનરંજન

ભવ ભય ભાંજન તુમ મજ રાજ, સાચો ૨

માઠન તારો દોષ નિવારો.

શમ ચરન ભવ તારણ જાજ. સાચો ૩

—( ૭૦ )—

આશા “ ભાગણુ ”

શમ ચરણુ ધર ધ્યાન, મુરખ મન શમ

જન્મ મુક્તિ તવ જ્ઞાન, મુરખ મન.

ટેક.

સાખી.

રામ નામ હૃદયે ધરો, જો આહો કલ્યાન;  
વેદ વચન ઉર ધારને, ભાવે બલે ભગવાન  
મુરખ મન રામ ચરણ ધર ધ્યાન

૧

સાખી.

મોહ મમતા મદ ત્યાગીને ધરવું ગુરૂ પદ ધ્યાન;  
આર પહારથ પામશે, અંતે પદ નિરવાન  
મુરખ મન રામ ચરણ ધર ધ્યાન

૨

સાખી.

માહન મન વિચારીને, ગુરૂ નયન કરકાન;  
જનમ મરણ દુખ ટાળવા. સેવો સંત મુજ્જન  
મુરખ મન રામ ચરણ ધર ધ્યાન

૩

—(૭૧)—

“ ભૈરવી “ આવોને ”

રામ કૃપાળુ શરણતિહારી, રામ.

ટેક.

દાસ નિહારી ભવજલ તારી

ધનુ હસ્ત ધારી, અરજ સ્વીકારી.

રામ ૧

ગૌતમ નારી આપ આધારી

અમુર બિહારી, મુની ભય ટારી

રામકૃપાળુ ૨

જનકદુલારી આપ પધારી

માહન મુધારી, અવધવિહારી.

રામ કૃપાળુ ૩

—(૭૨)—

ભૈરવી “ કોઈ ભોગીશને ”

જોઈ બાલુશને લઈએ લેને હો આજ;

વિધુ વહની બની જાઉં પ્રેમે પાવન.	ટેક૦
કુંજ ભુવન સુવાસ ખાસ રંજન મન્ન, વિધુ વહની ! બની જાઉં પ્રેમે પાવન.	૧
મોર મુકુટ મનોહર માથે ધરી; પેચાં પીતાંબર મોરલીએ મોહની કરી; નાથ નિરખે ને હરખે માડન્ન વિધુવહની ! બની જાઉં પ્રેમે પાવન્ન.	૨

—(૭૩)—

સારંગ “ પ્યારા મધુરસ્વર ”

પ્યારી સુરતપર જાઉં બલહારી	“ ૨ ”
સુરતી મનોહર શ્યામ સુંદર વર. પ્યારી સુરત—ટેક.	
યમુના આરે, ગૌધેન આરે, જ્વાલ સખા સંગ રાજે; એન બજાવત નટવર નાગર મહન મુરારી પ્યારી ૧ મોહનીહારી, શ્રીગિરધારી, નેન કટાક્ષ મારીરે, નંદ હુલારે, પ્રાણુ હમારે, માડન સુખકારી. પ્યારી. ૨	

—( ૭૪ )—

આશા “ હારે લાલા ”

હારે પ્યારા મોહનનંદન લાલા, રહો નહીં ન્યારા, બનવારી મોરારી ગિરધારી સગન સુખકારી છોગાળા પ્રેમાળા રૂપાળા.	હારે પ્યારા. ૧
બલીહારી નિહારી જાઉંવારો માડન મનધારી; હોસીલા રંગીલા રસીલા,	હારે પ્યારા. ૨

—(७५)—

धन्यात्री " इवी स्तुति "

संकटभी कर पार मातु भारी.	टेक.
मंगल करता लव दुःख हरता	
येक तारो आधार, मातु भारी संकट	१
जय जग हंसे आप आनंदे	
असुर विदारन हार.	मातु भारी २
काव्य कथानो लेह न जालु	
सेवक जाली सुधार.	मातु धारी ३
माडन आशा पुर्ण लवानी.	
हेवल मात हयाल.	मातु भारी ४

—( ७६ )—

कुंज " आशा ललित "

मन हरनारी प्यारी वसंत अहारी,	मन. टेक.
मावती कुली जय यंजेली, मोघरकी कली न्यारी मन.	१
अक्षर गुलाबी रंग जेरंगी	
अली गलु आर्ध तहां करत शुंजरी	मन. २
कैकिला शब्द माडन मधुरो;	
मैयुर मनोहर रव ललकारी.	मन. ३

—( ७७ )—

जीअटी " नागर नटवर "

मोहन वर मन हरलीनो रे—“ २ ”	टेक.
जेन अजवत नटवर नागर	“ जेवार ”

રંજન રસ જીનો રે.	મોહન ૧
ખીંદ્રાબનમેં રાસ રખે હે (૨)	
ચિત ચેર ચિત ચીનોરે,	મોહન ૨
સંગ સખા સખ હિલ મિલ ગાવલ (૨)	
મોહન મુખ દીનોરે.	મોહન ૩

—(૭૮)—

ધન્નાશ્રી “ મનતુ ”

સાનમાં તું માન ગુરખ, કામમાં ક્ષમાઈ જામા.	ટેક.
ધ્યાન તો ગુરુનું ધારી, મોહ મમતા તું દેને ટારી;	
હયાતી હસાઈ જામાં.	કામમાં ૧
માત તાત બ્રાત ભગની, મોહન માનો યેગી ક્ષમી;	
ઠાઠમા ઠથાઈ જામાં.	કામમાં ૨

—(૭૯)—

કનડો રજવાડી.

સખી કાન કુંવર મતવારે,	
નંદુલારે જશોમતી પ્યારે.	
જીવન પ્રાણુ હમારે.	સખી ટેક.
સ્વામ સુંદર મનહર બંસીધર, મોર મુકુટ શિરધારે;	
મોહન પીતાંબર મન રંજન, નિરખ મહન હિય હારે.	સખી ૧

—(૮૦)—

કવાલી—આતમબોધ!

અગમ છે દેવને બાઈ, અનોપમ દેહ તેં પાઈ



કસાયે લોભમાં બાઈ, પૂર્વની પુલ ગ્યો ખાઈ ૧  
 કયાં કુકમં હાંસાઈ, ગયો ભવલેર લૂટાઈ;  
 રહ્યો તું અંતમાં રોઈ, કમાઈ તેં બધી ખોઈ. ૨  
 દયાળુ દેવને બાણો, સદા સત સંગ સુખ માણો  
 વદે છે વેદ શું વાણી, જગત છે બાંજવા પાણી. ૩  
 જુનો માડન ધરમ ધારો, પ્રપંચી પંથને ટારો;  
 મલ્યો છે મોક્ષનો આરો, લાલ લ્યો નંદુલારો. ૪

—(૮૧)—

ભૈરવી “ કામસેન ”

અધર્મને તું ત્યાગરે, સુ ધર્મ ચિત્ત ધારરે. ટેક.  
 શરન લે તું સંતનો, નિજ ધર્મને વિચારને  
 માનને મહ મોહ મેલી, શ્રી રામચંદ્ર ઉચ્ચારને. ૧  
 કામ ક્રોધ લોભ મોહ, ઇરધાને ટારને  
 શ્વાસ સંગે જોઈ માડન, ચિત ઉચ્ચાર ઓંકારને. ૨

—(૮૨)—

ભૈરવી “ કચ્છી ” રાણા ”

ચિત લગો ચરણ મેં આજે (૨) ટેક.  
 તલલ લગી દિલ આંકે મિલનજ  
 મૈરમ બાણો મુંને મનજ  
 રમજ લગાઈ જાં રાંને. ચિત ૧  
 વતન વલો અય મધુસ નગરમેં,  
 ગુનયો તા નંદ જે ધરમે;

ગોકુલ કે કેર ગાંભે.

ચિત ૨

ડોની મડિશબ પગ પગ પિરીયમ

માફ કર્યો ચે માડન મેરમ

વલો વસીલો અસાંભે

ચિત ૩

—(૮૩)—

પહાડી “ બરફાણી ”

તજીદે કુરતાઈ, ધર શાંતતા ભાઈ “ ૨ ” ટેક.

નિજ આતમા ધારી, નહી દોષને ન્યારી.

અમીમય શબ્દ પાઈ. જગ દાસ પો બાઈ “ ૨ ” ૧

બનીતું ક્રોધ ધારી, નિજ દેહને બારી;

કરો માડન કમાઈ. નહી હોવત ઠઠાઈ. “ ૨ ” ૨

—( ૮૪ )—

આશા

સ્યામ સુંદર મળવા, રે જતન કર “ ૨ ” ટેક.

એન બબલે મન લલચવે, આનંદ ઉર કરવા. રે જતન ૧

મનહર માડન રૂપ નિહારે, જનમ મરન ટરવારે ૨

—( ૮૫ )—

આશા “ મધુરસી ”

હરખ નિરખ ગાઓ, શ્યામ સુખદાઈ. ટેક.

રૂપ મનોહર મુરતી મંગલ, બકુટી વિશાલ ભાલ

તિલક સુહાઈ.

હરખ ૧

आमंड हाता, भाडन त्राता, दशरथ जन्के  
कौशल्या भाई,

दुरा २

—( ८६ )—

पीछु रंग “पुंटी कोटी.”

छोडे छोडे मोहन आ याणारे.

जेवा भरोरी मटुकी होरी ओ नाहानी दुर. टेक.

साणी

गोरस जेवन मिस खली, संग सणी हो आर;

आई मिले यह गेलमे, कपटी नंद कुमार

ओ नाहानी दुर.

छांडे छांडे. १

साणी.

पोत दिनोका हानजे, ना छोडुं मज्जनार;

जानी अतुरता आपकी; भावी करत पोअर.

आ नाहानी दुर.

छांडे छांडे. २

साणी.

हुमे मैयारी कंसकी, गोरस जेवन जात;

यालव पकरी आयके, लुट दधी तुम भात;

ओ नाहानी दुर, छांडे छांडे.

३

साणी.

भाडन धन्य धरी आजकी, क्याम मिले मग भाई;

क्षमा करे अपराध सण, मान एवन जहूरार्थ;

ओ नाहानी दुर.

छांडे छांडे. ४

—(૧૭)—

આસા " વિંદાવની "

સ્વામ સુંદર ચિત ચોર, હમારે પ્યારે,  
સ્વામ સુંદર ચિત ચોર;  
મન હરનારે, દર્શ તુમારે પ્યારે  
સ્વામ સુંદર ચિત ચોર.

ટેક.

કુંજકે ખિહારી, પ્યારે ગિસીવર ખારી;  
બેન બલવે, મન લલચાવે

નટવર નંદ કિશોર હમારે પ્યારે

( ૨ ) ૧

આનંદ અગારી પ્યારે, મોહકું નિવારીરે  
પ્રેમવિલાસી, સદા ઉલાસી

માડન જનમન ચોર,

મનહરનારે દર્શ તુમારે પ્યારે,

સ્વામ (૨)

—( ૮૮ )—

પહાડી " પંજળી "

લકતા ઉધારણ, જન્મ સુધારણ

લવજલ તારણ, તુમહી હો.

ટેક.

પ્રહલાદ કારણ આપ પધારે,

દાસ ઉગરણ, તુમહી હો.

લકત ૧

મીરાં બચાવન નાથ નિરજન

નામ નિવારણ તુમહી હો,

લકત ૨

દિવ્યામિત્રકે યજ્ઞ સહાયક;

અમુર સંહારણુ, તુમહી હો.	ભકત ૩
માડન કહે મુનિ નારિ ઉધારી.	
વિપત વિહારણુ તુમહી હો.	ભકત ૪

—(૮૯)—

આશા “ રંગીલી ” રટનકર ”

ચંદ્ર શેષર તવનામ, મનોહર,	ટેક.
ભુષિત ભસ્મી, અંગબિરાજત	
લાલ ઈંદુ અભિરામ.	મનોહર ૧
સુલ નિવારી ત્રશુલ ધારી	
કામારી પુરણુ કામ	મનોહર ૨
નીલકંઠ શિર સુરસુરી ગાળે,	
આભુષણુ અહી શામ.	મનોહર ૩
અનુચર માડન શરણુ તુમારે,	
સેવક કે સુખધામ.	મનોહર ૪

—(૯૦)—

રાગ દેશ.

મોહ અવધપુર છાઈ, યહાં જન્મ લીયે રઘુરાઈ,	ટેક.
માત કૌશલ્યા, તાત વૃષ ઇશરથ,	
બાર બાર ઉરલાઈ,	મોહ અવધ ૧
રામ લક્ષ્મન ભરત શત્રુહન,	
હનુમત સંગ સહાઈ.	મોહ અવધ. ૨
નીર મનોહર સરણુ શોભિત,	

સ્ફટિક ઘાટ બનાઈ. મોઢ અવધ. ૩  
 અનુચર માડન દાસ તિહારો,  
 સ્વામી કરો સરસાઈ. મોઢ અવધ. ૪

સ્વામી શ્રી દયાનંદજી ઉર્ફે મુડીઆ બાવાની પ્રાર્થના.

—(૯૧)—

આશ " માંગણુ. "

દીન તણા હો આધાર, દયાનંદ સ્વામી "૨"  
 ભવજલ તારણુ હાર, દયાનંદ સ્વામી "૨" ટેક.  
 સાખી.

જ્ઞાન માન સનમાનથી, આપી માન અપાર,  
 વચન અમીમય પાઠને પાર પ્રભુ કરનાર.

દયાનંદ સ્વામી. ૧

સાખી.

કામ ક્રોધ મહ મોહમાં, ભમી રહ્યો મિસ્કીન  
 આશ એક ગુરૂ આપની, દેવ ઉશારો દીન.

દયાનંદ સ્વામી. ૨

સાખી.

દરશન આપી દાસને, કાપો પાપ અમાપ,  
 માડન મુરસદ મેર કરી, ટાળો ત્રવિધી તાપ.

દયાનંદ સ્વામી. ૩

—(૯૨)—

પદ ધન્યાશ્રી.

જન્મ ધર્યો જન કાજ, દયાનંદ સ્વામી, ટેક૦

અમિત જનને અભય કરો છે,  
 ડાળો દિલની દાજ.      દયાનંદ સ્વામી. ૧  
 સદમ તમ્હાં સુખ કરનાર,  
 રાખો ખાનાની લાજ.      દયાનંદ સ્વામી. ૨  
 કાવ્ય કલાનો લેહ ન ભાણું,  
 માન્ય કરો મહારાજ.      દયાનંદ સ્વામી. ૩  
 અનુચર માડન અરજ કરે છે,  
 તારણુ જકત જહાજ.      દયાનંદ સ્વામી. ૪

—(૯૩)—

રાગ ભૈરવ.

ખાંસુરી કી મુન મુન આનંદ અપારી અને હાં-હાં. ટેક.  
 કીટ મુકુટ મકરા કૃત કુંડલ,  
 બાલ મનોહર તિલક નિહારી અને હા = હાં, ખાંસુરી ૧  
 પીત પીતાંબર અંગ ગિરાજે,  
 શ્યામ સુંદર પર ભઈં બલહારી, અને હાં-હાં. ખાંસુરી ૨  
 અઘર અરૂમ વઠિં ગાલ ગુલાબી,  
 મનોહર મુરતી માડન મન પ્યારી. અને હાં-હાં, ખાંસુરી ૩

—(૯૪)—

ધનામી.

શ્યામ સુંદર ચિત ચોર, હમારે ખ્યારે,      ટેક૦  
 બિંદ્રાબન મેં ધેન ચરાવે,  
 નહાર નંદ કિરોલ, હમારે ખ્યારે. શ્યામ ૧

ज्वाल सभा संग हिल मिल जावत,  
 जामत आनहं जहोर, हमारे प्यारे श्याम २  
 मनहरनारे नंद दुलारे,  
 प्राणुएवन सिरभार. हमारे प्यारे; श्याम. ३  
 दशं तुभारा हिलमें आहत,  
 भाउन ज्यों धल मोर; हमारे प्यारे; श्याम. ४

—(५५)—

राय बैरवी " भोतेरा "

मन भश कीना चे भोहनवा. "२" टेक०  
 भोहनी मुरत मन हरनारी  
 श्यामकी सुरतपर वारीरे, भोहनवा. १  
 येन जलवत. भोहनी डारी.  
 कान क्वर जलीहासीरे. भोहनवा. २

साथी

बैर घटा छाछ छटा, पेणी सकत न पंथ  
 भाउन अपला यमकती, केसें पवे कथ.  
 मव भश कीनावे.. भोहनवा. ३

—(५६)—

धन्याथी " शुं कहुं कथनी "

आश तमारी धारी कान, कष्ट कापो गिरधारी. टेक०  
 मन भोहन बैर बियार, काना कष्ट कपो.  
 आरुण स्वीकारि आभारी लोभ,  
 श्याम मुहर सुभकारी।



जन्मो जन्मनी हासी तमारी,  
 इरशन ह्योने मारारी, कान-कष्ट कापो. १  
 अधम आधारणु नाथ निरंजन,  
 लकटा वत्सल लयहारी;  
 मान मोह मह लोल निवारो;  
 अनुचरी ह्योने उगारी. कान-कष्ट कापो. २

—( ८७ )—

आशा " भागणु "

राम कृष्ण भणवारे, मुरभमन (२)  
 जन्म भरणु टणवारे, मुरभ मन (२)  
 साप्पी.

टेक०

राम कृष्ण रसना रटो, आठो पोर आनंद  
 चार पदारथ पामशो, कायम निज सुभ कंड.

मुरभ १

साप्पी.

जन्म धरी हरी नही जप्या, सेव्या नही कोर्ध सत,  
 समय व्यर्थ वीतावीओ, आवी पडोच्यो अंत,

मुरभ २

साप्पी.

रामगुरु प्रसादशी, भाडननां महा लाज्य,  
 आशा त्रणु आणशी, उपच्यो हरी अनुराग.

मुरभ ३

—(૯૮)—

નટકેકાર.

ચપલા ચમકે, સરળે ધનવા,  
 બોલે દાદુરવા, ચપલા ચમકે ગરળે ધનવા. ટેક૦  
 મૈયુર મનોહર બોલન લાગે, મંદ મંદ મેહુલા વરસે;  
 હરશે બન કાનનવા. ચપલા ૧  
 જમુના ઝોર ગોધેન ચારે, માડન મધુરી બેન બબલે;  
 મનહરનારે મોહનવા. ચપલા ૨

—(૯૯)—

માલકોશ પીઠુ

મોહન મોહની મંત્ર ઉચા.....રી ટેક૦  
 ખંસી સુર સુની વ્યાકુલ બાલા,  
 પ્રાન ભવન સુખકા.....રી. મોહન. ૧  
 ધન્ય બિંદ્રાવન લાગ તિહારો,  
 બિહરત કુંજ બિહા.....રી. મોહન ૨  
 બનકી લકુટી કયા તપ કીને,  
 અધર સુધારસ પ્યા.....રી. મોહન ૩  
 માડન શ્યામા સ્યામ મિલેરી,  
 આનંદ વરસે વા.....રી. મોહન ૪

—(૧૦૦)—

આશા—“આવ્યો ધુ”

આનંદ હાતા જન સુખ વ્રાતા,  
શરણુ સુધારણુ જન સુખ જાજ. વૃ. ૧  
જન મન રંજન, ભવ ભય ભાંજન,  
માહન પ્રભુ છો સિરનારે તાજ. વૃ. ૨

—(૧૦૧)—

બાગેસરી-ત્રિતાલ.

કુલ પુલ ગુંજે,  
નવ નવલ લતા ગૃહ કુંજે—પુલ.  
સુવાસ સિંધુ, અનિલ ઉછાળે,  
મુદ મુદિત ભ્રમર રસ પુંજે—પુલ.

—(૧૦૧)—

ભૈરવી “મનમાં.”

ધ્યારા મનહર મોહન મળોધારે,  
મ્હારા જનમે મરણુ ભમ ટળીયા. ટેક૦  
નાગર નટવર આશ અમહરી, પુણું કરો ગિરધારી,  
નવરગ તમ મન વાહળીયા. મ્હારા. ૧

ફર કરો પ્રભુ દોષ અગારાં, ત્રિંદ્રાવનના વાસ્તી,  
માહન મોહન સુખ રાશી, પૂરવની પ્રીતે પળીયા. મારા. ૨

—(૧૦૨)—

ભૈરવી.

આવો આવો સુખ પ્રાપ્ત,

હરશન ઘોને ખ્યારા કાન.

ટેક૦

ખિંદ્રાબનને પાવન કરવા, આપ લગ્યું નિજ ધામ;  
કાન કુંવર મેર કરીને, વચન કરો પ્રિયમાન. આવો ૧  
નંદ દુલારા પ્રાણુ ખ્યારા, આપ કયોં એશાન;  
સરણુ સુધારન ભવજલ તારન, ધરે માડન પ્રણુ ધ્યાન. આવો. ૨

—( ૧૦૩ )—

રાગ ધનાશ્રી.

બદ્રીનાથ હયાલ, સંકટ હરો.

બદ્રી. ટેક૦

હરશન કરવા આશ અમારે

સંકટહરો ૧

આપછો દીન પ્રતિપાલ.

અમો અનુચર નાથ તમારા,

સંકટ હરો ૨

હરશન હયોને કૃપાલ.

સરન સનેહી છો સુખકારી,

સંકટ હરો ૩

ટાળો જમ દુખ બલ.

જનમ મરણુ રોગ ને ઘણો.

સંકટ હરો ૪

માડન બણી બાલ.

—( ૧૦૪ )—

રાગ ધન્યાશ્રી

બુલે લાલ હયાલ, કૃપાળુ દેવા.

બુલે. ટેક.

વંછિત ફલને અમો માયાળુ

કૃપાળુ દેવા ૧

કામો જનનાં શાખં.

ભવજલ તારણુ પાર ઉતારણુ

કૃપાળુ દેવા ૨

કરુણુ કરીને કૃપાળ.

મંગલ કરતા ભવ દુઃખ હરતા  
માડન જન પ્રતિપાલ.

કૃપાળુ દેવા ૩

—(૧૦૫)—

ધન્યાશ્રી “ માલિકને રાખવા ”

જય વિશ્વનાથ સુખકારી, ભાંગ ધતુરા અહારી. ટેક.  
ઉમા સંગ અરધંગ ખિરાજે, ગંગ જટા ધારી;  
નીલકંઠ કામારી, જય વિશ્વનાથ ૧  
નાગ છાલ વાઘાંભર રાજે; ભાલ ત્રિપુંડર સારી;  
માડન ભવ ભયહારી. જય વિશ્વનાથ ૨

—( ૧૦૬ )—

આશા “ માગણુ ”

નમન કરૂં પડું પેર, સદા શિવ  
આપ કરો પ્રભુ મેર,— સદાશિવ. નમન ટેક.  
સાખી:—રામેશ્વર દરશન દિલે, લાગી છે અભિલાષ;  
દયા કરી આ દીનને, પોચાએ હઈ પાંખ. સદા ૧  
સાખી:—આશુતોષ અરજી સુણી, લીઓ નિગામાં નાથ,  
અનુચર માડન આપનો, સમરથ રેજો સાથ. સદા ૨

—(૧૦૭)—

સીયાનો કાનરો.

ઓ કેલાસી ઘટઘટ વાસી, વેષ ઉદાશી  
છો અવિનાશી. ઓ કેલાશી. ટેક. ૧  
નીલકંઠ અરૂં કુંઠનમાળા,  
નાગ બિશાલા બિકસલા. ઓ કેલાશી ૧

અંગ વિભુતી સુંદર રાજે	
બાલ બિધુ છળી ભાલ બિરાજે,	ઓ કેલાશી ૨
પારવતી અરધંગ સુહાવે,	
મદન વિમદન સુખ વરસાવે	ઓ કેલાશી ૩
ચંદ્ર શેખર તવ નામ મનોહર,	
માડન હરહર શીવહર શંકર.	ઓ કેલાશી ૪

—(૧૦૮)—

રાગ સોયની.

આશા અમારી, સ્વામી સ્વીકારી, અંથ સુધારી.	
દયો ગિરધારી,	ટેક૦
બાલ બિચારી, ચુક વિસારી	
પ્રેમ પસારી, દેવ મુસારી.	આશ ૧
દોષ નિવારી, વાણી પ્યારી	
નેહ નિહારી, મેર વધારી.	આશ ૨
રામ ખસારી, અવધ બિહારી,	
માડન વારી. બહિં બલિહારી.	આશ ૩

—(૧૦૯)—

કલાલી “કલ્યાન” વદે તેવું.

અહો મમ પ્રાણુય પ્યારા,	
સહોદર ભવન મહારા;	
વચનને માન્ય કરનારા,	
સહા મમ હિત મહાનારા.	અહો. ટેક૦

સાખી.

લક્ષ્મણ ખ્યારા પ્રાણથી, જીવન પ્રાણ આધાર;  
મુછી ત્યાગો બંધવા, માડન શોક નિવાર.

સહા ચિત શાન્ત ધરનારા.

વિનોદી વાક્ય વહનારા. અહો. મમ. ૧

—( ૧૧૦ )—

ભૈરવી " ગણ્યા તમને પ્રાણુધર. "

મન મોહન પ્રાણ અમારા

છો છોગલા અક્ષુના તારા. ટેક

નાગર નટવર નંદ હુલારા,

આલ સખા સંગ ખેલે હો ખ્યારા;

માડન પ્રભુ વંછિત દેનારા,

મુખકર નડવર જગ સજનારા. મનમોહન ૧

—( ૧૧૧ )—

રાગ કલ્યાન:—કવાલી " વદે તેવું. "

મનોહર મુરતી ખ્યારી, મહા દુખ દોષ હરનારી,

રસીલી ભેન લલકારી, કડના શ્યામ ઉરધારી, ટેક૦

સાખી:—કીટ મુકુટ મુખ બંસરી, નાગર નંદકિશોર,

શોભા બરની ના બને માડન છળિ ચિત ચાર.

અમારી આશતો પુરી,

રમાડો સરહ ઉજાચારી.

મનોહર ૧





॥ ૐ ॥

દોહા.

મારૂંત સુત પદ વંદિકે, કરોં રામ ગુન ગાન;  
કરૂંતા કરિ નિજ દાસપેં, સહાય કરો ખલવાન. ૧  
રાગ રત્ન રસ માલિકા, નામ ગ્રંથ કો ધાર;  
પુરહુ આશ દયા કરી, તાતેં પાવો પાર. ૨  
ગુરૂ વંદના:—દોહા.

પ્રથમ કરોં ગુરૂ દેવકો, વંદન વારંવાર;  
રાગ રત્ન રસ માલિકા, દેહુ ગ્રંથ સુધાર. ૩  
દેવી સ્તુતિ:—દોહા.

આવડ દેવળ ઝોચરા, ખોઠલ ઘુટ ખલાર;  
આલકનેશ્રી આમુંડા, સંકટ હર કરવાર. ૪  
અભય કરો નિજ ખાલકો, વીશ હથી મુજે માત;  
વિદ્યાદાની વિધનહર, સુખકરણી સાક્ષાત. ૫  
સવૈયા અક્ષર ૨૩

વિન્ધ ઉપાવની તું જગપાલની, જકત સંહારની તું જગદંબા;  
ભકત ઉધારની કષ્ટ નિવારની, સ્વેં સુખકારનિ જે જગઅંબા;  
દુષ્ટ વિભંજની સભજન રંજની દેવિ નિરંજની પુણ્ય પ્રલંબા;  
વાહનસિંહ વિશાલ અશીકર, માહન-તારની અંખ અલંબા. ૬

કવિત અક્ષર ૩૧

નંદકે કુમાર ખ્યારે, મયુર મુકુટ ધારે;  
 ગોપ સંગ રેન હારે, નંદકે દુલારે હે;  
 જમુના પુલીન ખેલે, ખેનકે ખબને વાલે.  
 રાગની રસાલ ખ્યાલે, મનહર નારે હે;  
 મોઘર અંબેલી બય, દોલર ગુલાખ કુલે;  
 ફેલીહી સુગંધી ખહાર, લવ્ય લલકારે હે;  
 રાધિકા કે સંગ આલી, કરતહે ખાત ખ્યાલી;  
 માહન વિનોદ દાની, માવ મતવારે હે. ૭  
 જોખનમેં મદમાતી, ગાતીહી મધુર ગીત;  
 મંદ મુસકાતી રાતી આંખ અનીઆરી હે;  
 શ્રકુટી વિશાલ લાલ, શોભત ગુલાખી ગાલ,  
 મોતનકી માલ અંગ રંગ ઉજ્યારી હે;  
 હંસ ગતી રતી મતી, મોહક મયંક મુખી,  
 નાગન સી ખેની સાહી સુંદર સુધારી હે;  
 રાધિકા રસીક ખ્યારી, વાર વાર જાઉં વારી  
 માહન નિહારી પ્રખુલાનકી દુલારીહે. ૮  
 ગરૂકી સ્વારી સારી, કલાખી મુકુટ ધારી  
 કોટી કામ રૂપ હારી. સંખ ચક્રધારી હે;  
 નંદજી કે લાલ ખ્યારે, નીલકંજ અંગ વારે,  
 પીતહી વસન ધારે, જન સુખકારીહે;  
 જશોદા જીવન પ્રાન, જીવન કે પ્રાન દાન  
 રસીક કુંવર કાન, અધકો વિહારી હે;

માડન બળવે ઘેન, તાન માન ગાવે તાલ  
સંગઠી બિરાળે જ્વાલ, ગોવરધન ધારીહે.

૯

આશરો તિહારો અંબ, બાલક બિચારી આપ;  
આવડ મા કષ્ટ કાપ, સંકટ નિવારણી;  
મર્દની મર્ધવાસુર, ચંડ મુંડ ખંડની તું  
સેવક સુધારણી ત્યાં તોપ ત્રય ટારણી  
સાહકી પોકર સુની, સાગર ઝહાજ તારે  
દીન અરહાસ ધારી, સદા સુખ કારણી;  
ઝોરના આધાર મોરે, બાલક બચાય લીળે  
માડન શરણુ તોરે, વિધન વિક્ષરણી.

૧૦

માંગહુ બિચાર ખાત, કામની કરત ઘાત;  
અંગધાર નવસાત, ક્રોધ હી નિકારી કે;  
વારવાર પાય પરોં, વિનતી સ્વીકારી મેરી,  
અમૃત સમાન કરી દેખ દ્રગ ધારીકે;  
જીવન તું રામ જાન, જોરત હો દોય પાન,  
મોચન આધાર આન, માનતું બિચારી કે;  
રામ જન ગોંન કીન, લછન ન રહે લોંન  
સીયાજી સિધાત સંગ, અવધ ઉભરીહે.

૧૧

બાગકી મુંદર તાઈ મનહી લોભાઈ જાઈ,  
ત્રિવિધ સમીર પાઈ, મોહ ઉપજાવે હે;  
ઝલર શુલાખ જાએ, ચંબેલી ચો પાસ છાએ,  
જમર લોભાય ભાય, ચેન ચિત પાવે હે;  
આમૃકી છવાઈ ઘટા, નારંગી લલીત લતા,  
ચંબેલી નવેલી છટા, મોર મન ભાવે હે;

બંસુરી બજત લાલ, માડન મધુર ખ્યાલ;  
 જ્વાલ બાલ સંગ રંગ, રાગકોં જમાવે હે.  
 નંદજીકો છેયો છોટો, વેન કો ચરેયો મોટો;  
 બંસીકો બજેયો મેરો, મનહર લીનો હે;  
 રતનારે નેન વાંકે, બાંકે હે બિહારી લાલ;  
 અધર અરૂન તાકે, પ્રેમ રસ ભીનોહે;  
 આલી અવલોકો લાલ, જશોમતી પ્રિયબાલ;  
 રસીક બજાવે તાલ, પેર પટ જીનો હે;  
 માડન ઉમંગ અંગ, જ્વાલ બાલ રાજે રંગ;  
 દેખલો રસીક રંગ, નેન સેન દીનોહે.

૧૨

૧૩

જબે ધર્મ હોય નાશ, વસુધા પોકારે ખાસ;  
 રહાયક રમા નિવાસ, અર્જુ ઉર ધારીકેં;  
 સંત સુર સુખ દાતા, અસુર નિપાતા આતા.  
 તજી નિજ સ્થાન ત્રાતા, સંખ ચક્ર ધારીકેં;  
 માહવ વિનોદ દાની, દેવનકો દુઃખ ટારી;  
 દુષ્ટ દળ નષ્ટ કારી, અનાથ ઉગારી કે;  
 કંસકોં પછાયો ધાયો ગિરીરાજ સાર્યો કાજ  
 તાપકોં નિવાયો મહારાજ દયા ધારીકેં.

૧૪

કરલે વિચાર યાર, દુષણ નિકાર દાર  
 લગાકેં તું એક તાર, ગુરૂ ગુન ગાવરે;  
 જનમ સુધાર વેકો, કામ ક્રોધ મારવેકો;  
 અહંત નિવારવેકોં, આયો અમ દાવરે;  
 ઘટત ઘટત ભત, દીપ દરસાત તેસેં  
 આયુષ્ય સિરાત રાત દિન પલ પાવરે;

હરી ગુરૂ સંત માંઈ, માડન લગાઈ પ્રીત  
રાખ ચિત માઈ ભાઈ, ભલાઈ નિભાવરે.

૧૫

અરે ઓ વિચાર મન, તજીદે કુટીલપન;  
સંગમે' ન થલે ધન, ફૂરતા નિવારી લે,  
રંગહી પતંગી માન ઘારહુ દીવસ જન.  
અખહુ ન આઈ સાન, નામ ઉર ધારીલે;  
સંત હું સરણુ ધાર, તા તે' તું પાવે પાર;  
જન્મકી ન ખાવે માર, જન્મકોં સુધારી લે;  
જનમ અમુલ પાયો, માડનહી મન ભાયો,  
તરવેકો દાવ આયો, નાથકો નિહારીલે.

૧૬

યમુનાકે તીર ઠાઠો યેનહી ખજવે ખ્યારો,  
મોરહી મુકુટ વારો, નંદકો દુલારો હે;  
યમુના પુલીન રાજ શ્યામહી મિલન આજ.  
ઓરહી ખિસારો કાજ, ભાગકો ઉભરોહે;  
રસીક રસીલે લાલ, જશોદા જીવન ખાલ,  
કરત અનોખ ખ્યાલ, મન હરનારો હે;  
માડન પ્રવીન પ્રાન, દીજીએ દરશ દાન,  
દાસહી તુમારે માન, આશરો તુમારોહે.

૧૭

નામકે પ્રતાપ ભક્ત પ્રદહાદ આખાદ ભયે,  
અમરીષ ધ્રુજ આદી, અહલ્યા ઓધારીહે;  
બાલમીક વ્યાસ મુની ગનીકા ગયંદ તારે,  
નામકો પ્રતાપ ભારી, તાપ પાપ હારીહે;  
નામ નિસ તારે પાપી, મહા અગ દોષ કાપી,  
આઠો પોર યોગી ભાપી, સંત સુખકારીહે;

નામકો સંભારો યારો, માડન મંછીત હાતા,  
મોક્ષ પદ દેનહારો, નામ ભય હારીહો.

૧૮

દુષ્ટહીકો સંગ બરો કામ ક્રોધ લોભ મારો,  
માનસીક પાપ ટારો, સંત ચિત ધારોરી;  
હરી ગુરૂ સંત માંઈ, ઇષ્ટ ભાવ રાખો તાઈ,  
વેહ વાક્ય યાદ લાઈ, નેક ટેક પારોરી.

જનમ અમુલ પાઈ, ફાગટ ગુમાઈ ભાઈ,  
રામ નામ ચિત લાઈ, ગર્વકો નિકારોરી,  
જાત નાત માત તાત, વતીતા વિલાસ જાત,  
માડન શોભાત ગાત, મોહ કંઈ ટારોરી.

૧૯

સવૈયા.

વાક્ય વિચાર વિનોહ છટા પ્રત, જાનત ચોર કષ્ટુ ન આધાર,  
કાવ્ય કળા રસ રાજ્ય રૂપિંગલ વર્ણુ વિચાર નહી નિરધાર;  
સંગીત સાહિત માહિતકાર ન, સંત ઉદાર કરો ભવ પાર;  
રામ ગુરૂ મમ દોષ નિવારન માડન કોં ભવ તારન હારા. ૨૦  
દોષ નિવારન સંકટ ટારન પાર ઉતારન રામ ઉદારા,  
કામહી ક્રોધ નિવારન મો'મહ, દાસ ઉધારન તારન હારા;  
સંત સુધારણુ વારણુ તારણુ, રામ મિલાવન મોહ અપારા,  
રામહી નામ રટો નિશી વાસન, માડન વંછિત દાનિ વિચારા ૨૧.

સોરઠા.

સંત ચરણમે પ્રીત, સતગુરૂ રામ પ્રસાદતે,

સુખકર પ્રેમ પ્રતીત, જ્ઞાન દિયો દિલ ધરિ દયા. ૨૨

## સોરઠા:—પ્રથમાક્ષરે.

અરજ સુષી મહારાજ,	
જીવ ઉધારન મંદન અરિ;	
તમ હર ગરીબ નિવાજ,	
શંકર સુખ પ્રદ સંતકો.	૨૩
ગરલ કંઠ કલ રેખ,	
રામ રટત ભવ કટત ભય;	
એક અનંત અલેખ,	
ખરતન આગમ નિગમ નિત.	૨૪
જીવન જગ વિશ્રામ,	
ચિતવન ચિંતા હરતહો;	
રંજ ઘટોઘટ રામ,	
જગર રટો જગદીશકોં.	૨૫
વંછિત ફલ દાતાર,	
માઠન રટ મહાદેવકોં;	
રટત ઉમા ભરથાર,	
હોવત મોત વિનોદ નિત.	૨૬

## સોરઠા'—પ્રથમાક્ષરે નામ.

રામ નામ ધર ધ્યાન,  
મગન રહો ધુન મન ધરો;  
લાયક કરે શુન જાન,

लगन लगाई नामसें.	२७
सरन अंत डरी गुड़ अडो;	
एवन सकल सुजन,	
चित रंजन इल चार प्रद.	२८
रंग रागमे प्रीत,	
एत लजन मन जनता;	
विनय धर्मकी रीत,	
होवत चितमे नित नध.	२९

कवित.

अंसीके धरन हारे, कोटी काम रूप वारे,  
 नेत्र अनीआरे प्यारे, श्याम सुषकारीडे;  
 वारी धनश्याम अंग, राधिका गिराजे संग,  
 रसीक गिहारी रंग, आनंद अपारीडे.  
 आवणुकी घोर घटा, यपला यौआर छटा,  
 मैयुर निहारी रटा, रव ललकारीडे;  
 जमुना विलोकी वारी, मोह उपनय लारी,  
 श्याम रंग उरधारी, मोहनी पसारीडे. ३०  
 नंदके कुमार प्यारे, जमुनाके रोक आरे,  
 महीके लुटन हारे, राह रोक रयेडे;  
 सभी भिखी भात करे, आली जल डेसें लरे,  
 भातमे आय लरे, प्रेम हिये छाये डे.  
 श्यामके स्वयं देणी, ठाडी लई प्रज जाला,



આપકે દરશ કાજ, મન મસ્ત લયોહે;  
કીજીએ સનાથ આજ, મહારાજ સિરતાજ;  
રાજનકે રાજ મેરો મન હર લયોહે.

૩૧

સવૈયા.

બેન બળવત પ્રેમ બછાવત સેન જનાવત કૃષ્ણ કનાઈ,  
દાનહિ માંગત રાહહિ રોકત ગાવત ડોલત શ્રી જદુરાઈ;  
ગોરશ લુટત માટહી ફેરત બાંહ મરોરત માનત નાઈ,  
ધ્યાન તુમારોહિ ગાન તુમારોહિ માઠન માન હુમારો નશાઈ. ૩૨

કવિત:--પ્રથમાક્ષરે નામ !

શ્રી સુખ સુયશ દાની, નિરમાની ઉમાનાથ ?  
કાનન બીહારી કુંજ, કધલાશી વાશીહે;  
લીલાધર લહેરી ડાક, ડમરૂ નફેરી હાક,  
દાસ દુખ હારી સુખકારી રવે વિલાસીહે;  
શશી બાલ ભાલ રાજે. ગંગ જટા ગાજે ગેરી,  
નાગરિપુ છાલા વ્યાલ અંગર ઉદાશીહે;  
નર સુનીરાજ સુર, માઠન વિનોદ પાવે,  
શુવન સુફલતાઈ, ઈશ્વર ઉપાસીહે.

૩૩

કવિત:--પ્રથમાક્ષરે નામ !

શ્રી બંધુ બિરાજે ભાલ, બાલ છળી છટાદાર,  
કામારી નિસંગ ગંગ જટા જુટ ગાજેહે;  
નવલ નલીન નેન, હેમગિરી મુત્તા સંગ,  
શુતેંદ્રિ ભુજંગ અંગ, ભુવન બિરાજે હે;

બકી કૃપા કટાક્ષતે, માઠન વિનોદ મોહ,  
 દયા સિંધુ દીન અંધુ. નિરખી નિવાજે હે;  
 વરદાની સુલ ધારી ત્રયસુલ હારી ત્રાતા,  
 જીવન જાગીંદ્રરાજ, મહારાજ રાજેહે.

૩૪

કવિત:—પ્રથમાક્ષરે નામ !

મહાદેવ દયાસિંધુ દીન અંધુ લોખા શંભુ,  
 હાથમે' ત્રસુલ ત્રયસુલ હરનારેહો;  
 રાજે બાલ બિધુલાલ લોચન બિશાલ લાલ,  
 જગદીશ અહીશ કે, અલંકૃત ધારેહો;  
 શ્રી ભ્રાતા કંઠ ધારે નીલકંઠ નામ ન્યારે,  
 નાગાંબર શોભે પાર્વતી પ્રાણ પ્યારેહો;  
 નમન કરત કવી માઠનહે મોહ તાકો,  
 જીવા જીવ સ્વામી ઇષ્ટ શંકર હમારેહો.

૩૫

સર્વેયા:—પ્રથમાક્ષરે નામ ઠ

નાગ અલંકૃત અંગ ધરે ઉપવીત અહીરા નાગાંબર ધારી,  
 નગન જટીલ ચરાચર નાયક ગંગ જટા જુકિહે અગહારી;  
 જીવત આનંદ સાગરમે' સુખ સંપત વંછિત મંગલકારી,  
 ભાગ્ય ઉદે રટ માઠન શંકર પારવતી પતિ દેવ પુરારી. ૩૬

દોહા:—શ્રી શિવ સ્તુતિ !

અંગ જટા શશી લાલમે', અંગાભરણ અહીશ !  
 આસુતોષ જન દોષ હર, જ્ય મહેશ જગદીશ. ૩૭

वंछित मोह. विनोद प्रह, सुरनर सुनिवर सेव;  
 कैलाशी कल्याण कर, हर हर हर महादेव ? ३८  
 भाउन रट महादेवको' हर त्रशुल धर हाथ;  
 हीनअंधु ! सुअ सिंधु शिव, हे अनाथकेनाथ. ३९  
 भाउन दुरलभ मनुश तन, मिलवोहे मुक्केल;  
 शैल्यपती तनुजपती, शिव रट सअ सुअ सेल. ४९  
 भाउन सुभिर मडेशको, अन वंछित सुअ मोअ;  
 अर पदारथ हेतडे, संग असत गत हेअ. ४१  
 आन मुनी रस शुक्र अअ, मनहर आधव आस;  
 पुनम शुक्र प्रमोहकर, पुरअ अंथ प्रकाय,

---

हरि ॐ शांतिः शांतिः शांतिः

धति शिवम.

---



દાહા.

મંગલ મોહન મૂરતી, મંગલ મોહન ઐન;  
મંગલ મોહન ખાંસૂરી, ખિસરત નહિ દિન નેન. ૧  
મંગલ ચિતવન મોહની, ચિતરંજન ચિતચોર;  
ગોપીજન ગુન ગન રટે, મેઘ બપૈયા મોર. ૨  
કુંજ ખિહારી કરિ કૃપા, વિધ વિધ કરન વિલાસ,  
પ્રીતમ સહન પધારીએ, આયો કાર્તિક માસ. ૪  
છંદ ત્રણલી:—માત્રા ૩૨ " ૧૦-૮-૮-૬ "

કાતી શુભ આયે, શીત સુહાયે, બસન બનાયે, મન ભાયે,  
દંપતિ સુખપાયે, હિય હરખાયે, મહન સવાયે, તન છાયે;  
બરંધા રૂત બાયે, કમલ કુમાયે, કાશ કુલાયે, સરિતાસં,  
મોહન ધનમાસ, ઓઠંએ આશ, કરન હુલાસ, મજવાસં. ૧  
માગીશર માહી, બાડ બનાહી, પવન બહાહી, ઉતરાહી,  
તંબોલ ચવાહી, પીવન ચાહી, અંતરમાહી. લલકાહી;  
ખ્યારીનિજ શાંહી, હિયહુલાસાંહી પ્રેમ બછાહિ, કરિહાશં,  
મોહન ધન માસ, ઓઠંએ આશ, કરનહુલાસ મજ વાસં. ૨  
ચોસન પદુલાલં, ચોહતમાલં, દુપટ્ટમાલં, તિન કાલં,  
વિષધર મનીવાલં, અહિ વિકરાલં, રહત ખુશાલં પૈયાલં;  
શુંડન ધરમાલં, ઇશ કૃપાલં, રહત ક્યાલં, બલી પાસં.

મોહન ઇન માસં, ઑંઈએ આશં, કરન હુલાસં, પ્રજા ખાસં. ૩  
 માહે મદમાતી, વસંત બધાતી, નેન નચાતી, મુશકાતી,  
 હિયમેં હરખાતી, તન પ્રકુલાતી, સરસ સુહાતી, મુખ ગાતી;  
 ખેલત મૃદુખાતી, હથત હથાતી, ખેત બધાતી, અભિલાસં  
 મોહન ઇન માસં, આવન આશં, કરન હુલાસં, પ્રજા ખાસં. ૪  
 કાગનમેં હેરી, ખેલ જમ્બેરી, ગાવત ગોરી, તન ગોરી  
 નિજ નિજપતિ સોરી, કરખર જોરી, રંગ ભર ઝોરી, ડાયોરી;  
 અત્તર છરકયોરી, પટ ભિજ્યોરી, રસ ઉમજ્યોરી, ખાલાસં,  
 મોહન ઇન માસં, આયો અવાસં, કરન હુલાસં, પ્રજાખાસં. ૫  
 ચૈતર સર પાની, નિરમલ જાની, કુમુહ કુલાની, બિકશાની,  
 તાકેં પ્રિય ખાની, અલિ સુરતાની, કરત ગુંજાની, ગહરાની,  
 કોકિલ સુરઠાની, લતાખિટાની, ખેલત ખાની, ખ્યાલાસં;  
 મોહન ઇન માસં, ઑંઈએ આશં. કરન હુલાસં, પ્રજાખાસં. ૬  
 ઐસાખ બહારં, બાગ મનરં, ચઢે પુહારં, છટકારં;  
 કૂલન ભલકારં, મનુસર મારં, ભંમર અપારં, ગુંજરં;  
 પરિખત સુર સારં, કરત ઉચારં, બહત બચારં, ત્રય તાસં  
 મોહન ઇન માસં, ઑંઈએ આશં, કરન હુલાસં, પ્રજા ખાસં. ૭  
 જોઠં બનખેલી, જુગત જમ્બેલી, બહુત ખુલેલી, ચંમેલી,  
 નારંગ નારેલી, ધ્રાખ પકેલી, અંબ અંખેલી, ફલ ફેલી;  
 પ્રીતમ અલખેલી, કરત મુકેલી, ખેઠ હવેલી આગાસં  
 મોહન ઇનમાસં, ઑંઈએ આશં, કરન હુલાસં પ્રજાખાસં. ૮  
 અષાઠ મનોરં, કામની દોરં, ચાતુક સોરં, ચિત ચોરં,  
 બરખત ચહુઓર, ગરજ ઘોરં, કાદુર મોરં જિંગોરં;  
 સરિતા જલ જોરં, તરુવર તોરં, પુલ તારં,  
 મોહન ઇન માસં, ઑંઈએ આશં, કરન હુલાસં, પ્રજા ખાસં. ૯

શ્રાવન સરસાઈ, ઘટા ચઢાઈ, બાદલ આઈ, ખરસાઈ,  
 ગુનીબન મિલગાઈ કિશન બધાઈ, બાજ બબાઈ, હુલસાઈ;  
 હરિબન હરવાઈ, દરશન પાઈ, જુલત કન્હાઈ જુલાસં,  
 મોહન ઇન માસં, આઈએ આશં, કરન હુલાસં પ્રજબાસં. ૧૦  
 ભાદ મન ભાયં, ઘટા ચઢાયં, લલિલ સુહાયં, ખનરાયં,  
 બાદલ છવરાયં, ભાન છુપાયં, પુર ચલાયં, સરિતાયં;  
 ખેલી બલ પાયં, તરૂ લપટાયં, મનુ દરશાયં, કૈલાસં,  
 મોહન ઇન માસં, આઈએ આશં, કરન હુલાસં, પ્રજબાસં. ૧૧  
 આસુ નરનારી, ઉમંગ અપારી, સુદન સુધારી, સુખકારી,  
 બૂખન ચલકારી, પહિરત પ્યારી, સુંદર સારી, તન ધારી;  
 આવત દીવારી, દીપ હબારી, કરતહિ ભારી, પરકાશં,  
 મોહન ઇનમાસં, આઈએ આશં; કનહહુલાસં, પ્રજબાસં. ૧૨  
 પુરૂષોત્તમ પાસા, સફલ દિલાસા, અરત ઉદાસા, કર કપાસા,  
 આનંદ આવાસા, નાથ નિવાસા, બદભિલાસા, ઉર આશા;  
 ખરને ચહ માસા, દેવીદાસા મનહર પ્રાસા, બ્રજ ભાસા;  
 મોહન ઇન માસં, આયે અવાસં, કરન હુલાસં પ્રજબાસં- ૧૩

છપય.

નિજ દાસન હિત કરન, ધરનપર જ્ઞાન, બદાવન;  
 ગાવત વ્રજપતિ ગાથ, નાથ કલિ દોષ નસાવન;  
 ધાવન કરહુ પતીત, પ્રીત અનુચરપર કીજે,  
 લીજે જગ જશ સરસ, દરશ કરૂણાકર દીજે;  
 પુરન કૃપાલ ગોપાલ પ્રભુ. આયે અખ સંકટ હરન,  
 કર જુગલે જોર દેવો કહે, જ્ય જ્ય જ્ય અસરન સરન. ૧



અગાઉથી આશ્રય આપનાર ઉદારાત્મા

સદ્ગ્રહસ્થાના નામો:—



મુંબઇ.

- ૨૦ રા. રા. શેઠ શ્રી કાંનજીભાઈ જલવજી
- ૧૦ શ્રીયુત જોશીજી નાનજીભાઈ બાણજી
- ૧૦ ખત્રી વીશ્વનજીભાઈ બાણજી
- ૧૦ ભાવસાર તુલશીદાસભાઈ લઘા  
માતાજીની તુંબડી-કુચ.
- ૧૦ રા. રા. શેઠ શ્રી હંસરાજભાઈ  
નારાણજી
- ૫ હોથી અદાભાઈ કેશરજી  
પુંડી.
- ૫ શ્રીયુત જાડેજી શ્રી ખાનજી જલમ-  
સિંહજી
- ૫ જાડેજી શ્રી માધવસિંહજી સખરાજી  
બલધીયા.
- ૧૦ શ્રીયુત આયેશ શ્રી ખાલનાથજી  
કેરા.
- ૧ કલ્યાણી વાલજી વીરજી હાલાઈ  
કુંજાંર.
- ૧ જાડેજી સાંગાજી કેશરજી  
વાધોરા.
- ૧ બટ વીસનજી દેવરામ મોરલીમનો-  
હરના પુંજરી
- ૧ ગુાં દોલતગીરજી લખમજીગીરજી

કુચ પત્રી.

- ૧૦ મહેરખાંન રા. રા. ઠાકોરશ્રી ભગતજી  
સિંહ વિ. પ્રતાપસિંહજી  
કોઠારા.
- ૫ શા. શામજી આસપાર  
ટપર.
- ૨ જોસી વેલજી વાલજી  
લોંડીયા.
- ૨ ખારોટ જગરભાઈ મુરભાઈ
- ૨ ખારોટ નાથાજી મુરભાઈ  
હાવા.
- ૨ ખારોટ વીશાભાઈ દેહલભાઈ  
ખેડોઇ.
- ૫ રા. રા. ઠાકોરશ્રી જીમેદસિંહજી  
રતનસિંહજી
- ૨ ભીમાણી સુરતાંણજી સુમરાજી
- ૨ " કુડવરજી મેરજી
- ૨ " હેમતસંગજી જોસંગજી
- ૨ " તખતસિંહજી પતાજી
- ૨ " ખાંનજી ગોવીંદજી
- ૨ " ભુરુમા ધરજી
- ૨ " સુરજમલજીનાં વીધવા
- ૫ શ્રી સુરજયા



- ૧ ઠાકોરજીના પુનરી રાધીકાદાસજી રામદાસજી
- ૧ સેવક જ્જુરામ દામોદર
- ૧ મેરાઈ રતનજી ખેતા
- ૧ સોની પોપટ માધવજી

ખંભરા.

- ૨ મી. જોઠાભાઈ ભીમજી
- ૨ મી. વીરજીભાઈ વરજંગ
- ૨ મી. મનજીભાઈ પરખતભાઈ
- ૨ મી. પરખતભાઈ માવજી
- ૨ મી. રજુછોડભાઈ માવજી
- ૨ મી. રઘુભાઈ ભીમજી
- ૨ મી. રામજીભાઈ હરદાસ
- ૨ મી. કૃષ્ણભાઈ ખેંગાર
- ૨ ત્રીપાટી મયારામભાઈ વિ. ગોપાલજી
- ૨ સોની દેવજીભાઈ પ્રેમજી
- ૨ સોની કલ્યાણજી હીરજી
- ૨ મહારાજ જગજીવન પ્રાણજીવન
- ૨ મી. લીરાભાઈ રાજભાઈ
- ૨ મી. લઘુભાઈ ખેતાભાઈ
- ૨ મી. ભવનભાઈ જગમલ
- ૨ મી. દાનાભાઈ ખેંગાર
- ૨ મી. માવજીભાઈ જુઠા
- ૨ મી. માધવજીભાઈ નાથા
- ૨ મી. સાંમજીભાઈ ગોકુલ
- ૨ ઠા. મેષજી મોરારજી
- ૧ મી. નારાજી લાલજીભાઈ
- ૧ મી. ભર્તુ રઘુભાઈ
- ૧ મી. હીરા ખીમજી
- ૧ મી. ગોવાભાઈ ભારા
- ૧ મી. માધવજી ગોવા
- ૧ મી. રાજ વરજંગ

ખંભરા.

- ૫ શ્રીયુત સ્વામી શ્રીજીદયાનંદજી શ્રી ગુરુ બ્રહ્માનંદજી જીરે મુંડીયાવાળા
- ૨ માહારાજ શ્રી આશારામજી રામ-ચરણદાસજી વૈષ્ણવ
- ૨ માહારાજ શ્રી લક્ષ્મીદાસજી શ્રી ગુરુ નારાયણદાસજી વૈષ્ણવ
- ૧ કંસારા દેવકરજી મુંદરજી દેવરીયા.
- ૫ મી. રતનાભાઈ મેપા નાગલપુર.
- ૨ મી. લધાભાઈ કચરા
- ૨ મી. જોઠાભાઈ મુરજી
- ૩ જાડેજી બનેસંગજી કરશનજી
- ૧ જાડેજી જલમસંગજી પતાજી
- ૧ કુમારશ્રી ભૂપતસંગજી જોડુજી
- ૧ રાવલ રામજી દેવજી
- ૧ રાવલ જીવરામ દેવજી
- ૨ ઠા. મુરારજી દેવજી
- ૧ માસ્તર નાનાલાલ ભગવાનલાલ
- ૧ શા. માણક કચરા નિ. દેશલપુર
- ૧ શા. જોતસી દેરાજી
- ૧ શા. ખેતસી કરમસી
- ૧ શા. કેશવજી લખમસી
- ૧ શા. પ્રેમજી હંસરાજ
- ૧ દેવે ઝવેરીલાલ જટાશંકર
- ૧ શા. ચના લખમસી
- ૧ જાડેજી સુલતાનજી વખતસંગજી
- ૧ રંગીલદાસ પ્રજારામ
- ૧ શા. વિસનજી જોવંત
- ૧ કણ્ઠી નારાયણ દેવશી

- ૧૦ દેશાઇ પોપટભાઇ વાં. ખોડીદાસ  
 ૧ ખોળ રાશીદભાઇ અલારખ્યા.  
 ૧ રાજગૌર પુંજ ધનજી

પત્રી.

- ૨૫ રા. રા. સ્નેહી સિરતાજ નડેશી  
 અજીતસિંહજી રાયમજી  
 ૧૦ રા. રા. નડેજી શ્રી પચાણજી સાંગાજી  
 ૧૦ રા. રા. નડેજી શ્રી લાધાજી સાંગાજી  
 ૨ રા. રા. નડેજી શ્રી રાએધરજી  
 ઉમરસિંહજી.  
 ૧ કુમારશ્રી અભયસિંહજી વિ. મદાર-  
 સિંહજી.  
 ૫ રા. રા. પત્રી સ્કુલ માસ્તર લક્ષ્મી-  
 દાસભાઇ ધ્યાલ.  
 ૫ શેઠ સામજીભાઇ ઉમસીભાઇ  
 ૫ શેઠ હરીરામ લીલાધર  
 ૧ સ્વામીશ્રી શંકરગિરજી ગુરૂ હીરા-  
 ગિરજી  
 ૧ શા. કચુભાઈ ખીમજીની કંપની  
 ૧ શા. ઉમરશી જેઠાભાઇ  
 ૫ શેઠ લીલાધર કાનજીભાઇ કાર્યભારી  
 ૧ મી. મોરારજી વિ. દામોદર જોશી  
 ૨ નડેજી શ્રી દેવાજી રામસંગજી  
 ૧ મારાજશ્રી રણછોડભાઇ જેઠા. પત્રી  
 ૧ મારાજશ્રી પુંજભાઇ ધનજી. વાંકી  
 ૧ રાજગર કાનજી ભવાનજી. પત્રી  
 ૨ શોઠાશ્રી હળુજી દોશાજી વડજર  
 જગીરદાર

- ૩ શોઠા કુમારશ્રી પ્રતાપસંગજી ખેતાજી  
 વડજર જગીરદાર  
 ૨ મહિ દેવશી ગોપાળજી કામદાર  
 ૨ ઠા. નારણજી રતનશી કોઠારી  
 ૨ ઠા. શવજી મોરારજી  
 ૨ ગાંધી પોપટ જીવરાજ  
 ૨ ગાંધી વેલજી નાજી  
 ૨ ગાંધી શવજી લધા  
 ૨ શા. વેલજી મેઘરાજ  
 ૨ ઠા. મુરજી લધા માજી કામદાર  
 ૨ ઠા. કુકુભાઈ લાલજી માસ્તર  
 ૨ ઠા. મુરજી કલ્યાણ મેઘજી  
 ૧ શેઠ દેવજીભાઈ મુરજી ઠંકર વડજર  
 ૧ શેઠ વેલજીભાઈ કાનજી બગડાવાલા.  
 ૧ શા. શામજી શવજી વડજર  
 ૧ ઠા. લીલાધર મેગજી "  
 ૧ શા. વાધા માણુક "  
 ૧ રાજગર બાણુજી વશનજી "  
 ૧ ઠા. મમુભાઈ મુરજી "  
 ૧ ઠા. કલ્યાણુજી ખજુર "  
 ૧ ઠા. મુરજી કાનજી "  
 ૧ ઠા. કારા ભીમજી "  
 ૧ ઠા. પ્રાગજી મેઘજી "  
 ૧ ઠા. ખેરાજી મેઘજી "  
 ૧ ઠા. કાનજી લાલજી "  
 ૧ ઠા. જીવરાજ લાલજી "  
 ૧ ઠા. નદવજી હરભમ "  
 ૧ ઠા. ભીમજી હરભમ "  
 ૧ શા. ઠાકરશી શવજી "  
 ૧ શા. પાશવીર લખમશી "



## शुद्धि पत्र.

प्रश्न	लीटी	अशुद्ध	शुद्ध
४८	५	गवि	ठवि
४८	१८	भोभो	भोभो
५०	५	कइता	कइता
५६	१८	भोत	भोह
५७	३	नथी ते लभवी	दान मान सनमान
५७	२२	आतभें	आतन भें
५८	५	जगींद्रराज	योगींद्रराज
५	१६	अहीरा	अहीश
५८	१८	छलत	छलत
५	८	गत	गन
५	११	प्रकाय	प्रकाश
६२	२२	सरिता जल जेरं ते पछी नथी ते ?	करत दिखारं
६२	२२	तारा	नाशं
६३	६	ललिल	ललित
६७	३०	नथी लभेल ते लभतुं	२५ वडजर कारभारी आह- भभाधं जोशभाजुभाध पारड

# સમાજ જીવન.

સામાજિક નૈતિક સાંસારિક વિષયો સ્વતંત્રપણે ચર્ચાતું, આ બાળવૃદ્ધ, સ્ત્રી પુરૂષ, સર્વને એક સરખું ઉપયોગી સસ્તામાં સસ્તું, સચિત્ર અને મુંબાઈ ઇલાકામાં અતિ લોકપ્રિય થઈ પડેલું માસિક પત્ર.

જેમાં દરમાસે રસમય સાંસારિક વાર્તા, મહાપુરૂષોનાં જીવન ચરિત્ર, તથા 'સ્ત્રી જગત્' વિભાગમાં ખાસ વિદુષી ખંડેનોના હાથે લખાતી અતિ ઉપયોગી લેખાવલિ આવે છે.

આપણાં શુષ્ક બનેલા ગૃહજીવનમાં નવચેતન રેટનાર આ એક જ માસિક છે.

વાર્ષિક લલાજમ.

હિન્દ માટે રૂ. ૩-૦-૦

હિન્દ બહાર રૂ. ૩-૧૨-૦

છુટક નકલ રૂ. ૦-૬-૦

નમુનાનો અંક મંગાવી ખાત્રી કરો.

ગ્રાહક થનારને સપ્ટેમ્બર માસનો ૨૦ ફોર્મનો સચિત્ર દળદાર અંક જેની છુટક કીંમત રૂ. ૦-૧૨-૦ છે તે એમ જ મળે છે.

બહાર ખબર માટે ઉત્તમોત્તમ સાધન છે.

લખા.

નારાયણજી ગોકળદાસ ડોસાણી.

અધિપતિ, સમાજજીવન.

કીકાસ્ટ્રીટ-મુંબાઈ નં ૪.

